

શ્રી યશોવિજયજી
જૈન ગ્રંથમાળા

દાદાસાહેબ, ભાવનગર.

ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨

૩૦૦૪૮૪૬

અનુયોગાચાર્ય પં. શ્રીકંચનવિજયજી ગણિવર્ય.



જન્મ સં. ૧૯૪૪ ગઢડા

દીક્ષા સં. ૧૯૭૫ જોટાણા

વડી દીક્ષા સં. ૧૯૭૫ સમી

ગણિપદ સં. ૧૯૯૧ પાલીતાણા

પંચાસપદ સં. ૧૯૯૧ પાલીતાણા

પંન્યાસજી મહારાજશ્રી કંચનવિજયજી ગણિવર્યાનું

કુંક જીવન ચરિત્ર.




તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરનાર, તાલધ્વજ વિગેરે પતિત-પાવન તીર્થોથી પવિત્ર શ્રી સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ભાવનગર સ્ટેટમાં ગઢડા નામના શહેરમાં સુપ્રસિદ્ધ વેદાણી કુટુંબના ભાવસાર ઇગનાથ દુર્લભદાસ રહેતા હતા. તેઓ દરબારશ્રી મંગલસિંહજીના વિશ્વાસપાત્ર અને કોઠારી શ્રીમાન્ ભાવસાર ભવાન હરખાની સુપુત્રી બાઈ મોંઘી સાથે પરણ્યા હતા. ગઢડામાં સ્થાનકવાસી સાધુઓના વિશેષ સંસર્ગને લીધે ઇગનાથભાઈમાં સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડ્યા હતા, જ્યારે બેન મોંઘીને તેમના પિતાશ્રી તરફથી મૂર્તિપૂજક જૈનધર્મના સંસ્કાર પડ્યા હતા; છતાં ભદ્રક પરિણામી બન્ને પ્રેમાળ દંપતી પોતપોતાની માન્યતા મુજબ ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા. શ્રીચુત ઇગનાથભાઈને તેમના પ્રેમાળ અને માયાળુ ધર્મપત્ની બાઈ મોંઘીની કુક્ષિએ હરજીવનદાસ, નાનાલાલ, જગજીવનદાસ, નરોત્તમદાસ અને ઝવેરચંદ નામે પાંચ પુત્રો; તથા બેન કંકુ અને અજવાળી નામે બે પુત્રીની પ્રાપ્તિ થઈ. તેઓમાં આપણા ચરિત્ર નાયક પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિ, જેમનું સંસારી નામ હરજીવનદાસ હતું, તેમનો જન્મ વિક્રમ

સંવત ૧૯૪૪ ના માગશર વદિ ૩ શુક્રવારના શુભ દિવસે થયો હતો. રૂગનાથભાઈ ખડા સાહસિક વ્યાપારી હતા. તેમને ગઢડામાં અનાજની ધમધોકાર દુકાન ચાલતી હતી. કિસ્મતની ચારી મળતાં તેમણે ચલાડીયા અને ભાવનગરમાં પણ દુકાન ખોલી. આવી રીતે તેઓ વ્યાપાર-ધંધે તથા કૌટુંબિક સુખથી તરખતર રહેવા લાગ્યા. પરંતુ આ દુનિયામાં એવા કોઈક જ ભાગ્યશાળી હોય છે કે જેઓ આખી જીંદગી દરેક પ્રકારે સુખી રહે. કુદરતનો અટલ કાયદો છે કે, ભરતી પછી ઓટ અને ઉદય પછી અસ્ત અવશ્ય થાય છે. એક સરખા દિવસ કોઈના જતા નથી. લક્ષ્મીની ભરતી હતી તેને બદલે હવે ઓટનો વારો આવ્યો. વ્યાપારમાં કાંઈક ખોટ આવવા લાગી અને કાંઈક કળખાદ પડવા લાગી. વળી પોતાના પુત્રો ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરેને કેળવણી આપવાનું ગઢડામાં બેઠેએ તેવું સાધન નહોતું, જેથી તેઓ પોતાના કુટુંબ સાથે ગઢડાથી ભાવનગર આવીને વસ્યા, અને ભાઈ હરજીવનદાસ વિગેરેને કેળવણી અપાવવાનું શરૂ કરી દીધું.

વ્યવહારિક કેળવણી.

ભાઈશ્રી હરજીવનદાસે ભાવનગરમાં મામાના કોઠા પાસે આવેલી ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ શરૂ કર્યો. પોતે બુદ્ધિશાળી હોવાથી દરેક વર્ગમાં ઉંચો નંબર રાખતા, વિનય-શીલ હોવાથી સ્કૂલના માસ્તરોની અમીદષ્ટિના પાત્ર બન્યા હતા. ટાઈમસર સ્કૂલમાં જતા, અને ત્યાંથી છુટી સીધા ઘેર આવી અભ્યાસમાંજ દત્તચિત્ત રહેતા. આ સ્કૂલમાં કમસર

ચાર ગુજરાતી પૂર્ણ કરી અંગ્રેજી અભ્યાસ માટે એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલમાં દાખલ થયા. ત્યાં એ અંગ્રેજી સાથે પાંચમી અને છઠ્ઠી ગુજરાતી પૂર્ણ કરી ત્રીજી અંગ્રેજીમાં દાખલ થયા, તે સાથે સાતમી ગુજરાતીનો પણ અભ્યાસ ચાલુ થયો.



શરીરે તાંદુરસ્ત, સ્વરૂપવાન, અને અભ્યાસમાં આગળ વધતા ભાઈશ્રી હરજીવનદાસના વેવિશાળની વાતચીત ભાવનગરમાં તથા બહારગામ ચાલવા માંડી. એ જમાનામાં ભાવસાર જ્ઞાતિમાં નાની ઉમ્મરના દિકરા-દિકરીનું વેવિશાળ અને લગ્ન થાય તેમાં આબરૂ મનાતી ! પુત્ર કે પુત્રી મોટી ઉમ્મરના થવા છતાં વેવિશાળ કે લગ્ન ન થયાં હોય તો તેમાં માનહાનિ ગણાતી ! ભાઈશ્રી હરજીવનદાસના માત-પિતાએ પોતાના પુત્રનું વેવિશાળ કરી લહાવો લેવાનો નિર્ણય કર્યો, અને ભાવનગર વડવામાં રહેતા ભાવસાર ત્રિકમદાસ નર-શીદાસના સુપુત્રી બેન રતન સાથે વેવિશાળ કરી સંવત ૧૯૫૭ના મહા શુદ્ધિ પંચમીના શુભ દિવસે ઘણા જ ઠાઠમાઠથી લગ્ન કર્યું.

સ્થાનકવાસી મટી મૂર્તિપૂજક બનેલા પિતાશ્રી

આપણે અગાઉ જણાવી ગયા તેમ ભાઈ શ્રી હરજીવનદાસના પિતાશ્રીને સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડ્યા હતા, તેમને પ્રતિમાજી તરફ બિલકુલ શ્રદ્ધા નહોતી. જ્યારે ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરે ભાઈઓ, બહેનો તથા તેમનાં

માતૃશ્રીને મૂર્તિપૂજક જૈન તરીકેના સંસ્કાર પડ્યા હતા. ભાઈશ્રી હરજીવનદાસને નાનપણથી જ વીતરાગ પરમાત્માના પ્રતિમાજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી. હવે તો તેઓ સમજણા પણ થયા હતા, જેથી પોતાના પિતાશ્રી દેરાસર ન જતા હોવાથી તેમને અયોગ્ય લાગવા માંડ્યું. જેથી તેઓ ઘણી જ નમ્રતાથી પિતાજીને કહેતા કે “ આપુજી ! આજે તો પૂજા લણાવાય છે. આંગી સુંદર છે, રાત્રે ભાવના છે. ” આવી આવી વાતો કરી પિતાજીને દેરાસર લઈ જતા. પછી તો પૂછવુંજ શું ? વીતરાગ પરમાત્માના અલૌકિક પ્રતિમાજીનાં દર્શન, તેમના આગળ સંગીતના સરોદો વગરે ભાવવાહી ગવાતી પૂજાઓ અને સ્તવનો, સુંદર અને આકર્ષક અંગરચના અને સેંકડો નર-નારીઓનો લક્ષ્મીભાવ; આ બધું જોઈ ભદ્રક પરિણામી રૂગનાથભાઈને હૃદયોલ્લાસ થયો. તેમણે પોતાના ચિત્તમાં વિચાર્યું કે “ પ્રતિમાજીને માનવા જોઈએ, તેમનું બહુમાન અને પુજા કરવી જોઈએ. ” પછી તો ભાઈશ્રી હરજીવનદાસની પ્રેરણા વગર જ તેમના પિતાશ્રીએ દેરાસર જવાનું અને પ્રભુપૂજા કરવાનું ચાલુ કરી દીધું, અને પ્રતિમાજી પ્રત્યે દૈવ શ્રદ્ધા થઈ ગઈ.

મીલમાં થયેલી જોખર તરીકેની નીમણુક.

ભાઈ શ્રી હરજીવનદાસે સ્કૂલમાં ઇંગ્લીશ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેઓ કુરસદ મળતાં કોઈ કોઈ વાર શેઠ વેણીશંકર લાખીયાની મીલ જોવા જતા અને કારીગરોનાં લિન્ન લિન્ન કામ બારીકાઈથી તપાસતા. તેમને વિચાર આવ્યો

કે ‘આ કામ ધ્યાન રાખીને કરીએ તો આવડી જાય તેવું છે.’ જેથી વેકેશનની રજા પડતાં તેઓ મીલમાં ગયા અને મેનેજરને મળી કાંઈક કામ સોંપવાનું કહ્યું. તાંદુરસ્ત અને ચક્રેર આ ઉગતા યુવકને જોઈ મેનેજરે ઘણીજ ખુશીથી કામ ખતાવ્યું. ભાઈ શ્રી હરજીવનદાસે એ કામ ખંતથી કરવું ચાલુ રાખ્યું, એટલુંજ નહિ, એ કામ જોઈ મેનેજરે સંતોષ વ્યક્ત કર્યો, અને તેમણે હાર્દિક લાગણીથી ભાઈશ્રી હરજીવનદાસને જોખર તરીકે નિયુક્ત કર્યા.

ભાઈ શ્રી હરજીવનદાસના લગ્ન થયા, તે અગાઉ તેમના ત્રણ ભાઈઓ જગજીવનદાસ, નરોત્તમદાસ અને ઝવેરચંદ ગુજરી ગયા હતા. એક ભાઈ નાનાલાલ હયાત હતા. પિતાશ્રી તથા ભાઈ નાનાલાલ વાળુકડવાળા મનેર હરખાને ત્યાં નોકરી કરતા હતા, પરંતુ એટલાથી ઘરનો ખર્ચ પૂરો ન થવાથી ભાઈ શ્રી હરજીવનદાસને અભ્યાસ છોડી મીલમાં નોકરી સ્વીકારવી પડી હતી. તેમના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત્ ૧૯૬૦ ની સાલમાં પુત્રીનો જન્મ થયો, જેનું નામ હીરા રાખવામાં આવ્યું.

અમદાવાદ તરફ પ્રયાણ-
મીલમાં હેડ જોખર તરીકે નીમણુંક


હવે તો ભાઈ શ્રી હરજીવનદાસને માથે વ્યવહારિક જવાબદારી દિવસે દિવસે વધવા લાગી. પિતાજી, ભાઈ શ્રી નાનાલાલ તથા પોતાની નોકરી ચાલુ હતી, પરંતુ એ સમયે કાઠિયાવાડમાં નોકરીનું ધોરણ ઘણું નીચું હતું. જેથી નોકરીની દુકી આવ-

ક્રમાં ઘરનો ખર્ચ કરકસરથી નભતો હતો, આર્થિક સ્થિતિ નબળી હોવાથી હરજીવનદાસે વિચાર્યું કે “ પરદેશ ખેડવા વગર આર્થિક સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. ” તેમણે મીલોના મથક ગણાતા અમદાવાદ જવાનો નિર્ણય કર્યો, અને સંવત્ ૧૯૬૦ ની સાલમાં પોતાનાં ધર્મપત્ની બાઈ રતન અને પુત્રી બેન હીરા સાથે અમદાવાદ તરફ રવાના થયા. તેમની સાથે મીલનું કામકાજ જાણનાર બીજા પંદર કારીગરો જવાને તૈયાર થયા હતા, ઉદાર દિલના ભાઈ શ્રી હરજીવનદાસ તેમને પણ સાથે તેડતા ગયા. નવયુવક અને મીલના કામમાં પ્રવીણ ભાઈ શ્રી હરજીવનદાસની અમદાવાદમાં મંગલદાસ ગીરધરલાલની મીલમાં માસિક રૂપિયા ૨૫૦, ના પગારે હેડ બેબર તરીકે નીમણૂક થઈ, અને પોતાની સાથે આવેલા કામદારોને પણ એજ મીલમાં ગોઠવી દીધા.

ઉદાર અને કૌમળ હૃદયના હરજીવનદાસ

આવી રીતે ભાઈ શ્રી હરજીવનદાસ પોતાની પ્રેમાળ અને વ્યવહારદક્ષ પત્ની બાઈ રતન સાથે અમદાવાદમાં સુખચેતથી રહેતા હતા. દેશમાંથી નોકરી શોધતા કેઈ ઓળખીતા માણસો આવે તેમને નોકરી ન મળે ત્યાં સુધી ઉદાર હૃદયના ભાઈ શ્રી હરજીવનદાસ પોતાને ઘેર વિના સંકોચે જમાડતા, અને સૂવા-ખેસવાની સગડ ન હોય તો એ પણ કરી આપતા. એટલું જ નહિ, પણ બનતે પ્રયાસે પોતાની લાગવગ વાપરીને તથા જરૂર પડે તો પોતાની ઓળખાણ આપીને પણ નોકરી મેળવી આપતા. તેમના ધર્મપત્ની કૌમળ હૃદયના બેન રતન

પણ પોતાના પતિને આવા ઉપકારી કાર્યમાં પ્રોત્સાહિત કરતા, અને પતિની આજ્ઞા મુજબ આગંતુક માણસોની આગતા-સ્વાગતા ખડે પગે કરતા. ભાઈ શ્રી હરજીવનદાસ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી દર પૂનમે સ્નેહીવર્ગ સાથે પાનસરની યાત્રા કરવા જતા, અને ત્યાં ઠાઠમાઠથી પ્રભુભક્તિ કરતા. તેમને માસિક રૂપિયા ૨૫૦, નો પગાર મળતો. હોવાથી અને એ વખતમાં વિશેષ મોંઘવારી ન હોવાથી જો ધારત તો ઠીક-ઠીક રકમ એકઠી કરી શકત. પરંતુ નોકરી વગરના અને નિરાધાર માણસોને જોઈ તેમનું હૃદય દ્રવી જતું, અને નોકરીમાં જે કાંઈ વધારો રહેતો તે આવા માણસોને મદદ આપવાના પરોપકારી કામમાં વપરાઈ જતો.



ભાઈ શ્રી હરજીવનદાસ જોખર તરીકે માણસો પાસેથી માયા-ગુપણે અને મીઠાશથી રીતસર કામ લેતા, જેથી ઉપરી અધિકારીને તેમના કામથી સંતોષ થતો. તેઓ મીલમાં સ્વમાન પૂર્વક સ્વતંત્રપણે વર્તતા, તેમને ખુશામતખોરી બિલકુલ પસંદ નહોતી. જેથી મીલના મેનેજર કે ઉપરી અધિકારી તરફથી સ્વમાન ઘવાયાનો જરા સરખો પ્રસંગ ઉપસ્થિત થતા, તેઓ તુરત રાજીનામું આપી છૂટાં થતાં, અને બીજી મીલમાં ગોઠવાઈ જતા. આવી રીતે અમદાવાદના વસવાટ દરમિયાન તેમણે જુદી જુદી ત્રણ મીલમાં નોકરી કરી હતી.

ખ્યાવરની મીલમાં નોકરી, સખ્ત કામકાજથી લાગુ
પડેલો ક્ષયરોગ, દેશી દવાથી રોગ શમન

તેમણે સાંભળ્યું કે, ખ્યાવરની મીલમાં પગાર સારો આપે છે, અને કામદારો પ્રત્યે ઉપરી અધિકારીનો વર્તાવ માયાળુ છે. આ પ્રમાણે સાંભળી તેઓ સંવત ૧૯૬૩ ની સાલમાં પોતાની ધર્મપત્ની તથા પુત્રી સાથે ખ્યાવર ગયા, અને ત્યાંની એડવર્ડ મીલમાં જોખર તરીકેની જગ્યા મળી ગઈ. અહીં લાવનગરવાળા શેઠ એઘડલાઈ રામજીના સત્સંગથી ધાર્મિક સંસ્કાર દઢ થયા. વળી આચાર્યજી મહારાજ શ્રી વિજયવીર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી, જેમાં તેમણે બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કર્યો. આ અરસામાં મીલના સખ્ત કામકાજને લીધે લાઈ શ્રી હરજીવનદાસને ક્ષયરોગ લાગુ પડ્યો. જીર્ણ જ્વર અને ઉધરસ સાથે શરીરે નબળાઈ વરતાવા લાગી. તેઓ સંવત ૧૯૬૫ માં ખ્યાવરથી તુરત અમદાવાદ આવ્યા, અને ક્ષયરોગને નાબુદ કરવામાં કાબેલ ગણાતા એક દેશી વૈદની દવા ચાલુ કરી દીધી. દવા લાગુ પડી, અને છ મહિનામાં ક્ષયરોગ નાબુદ થતાં શરીર સુધરી ગયું.

અમદાવાદમાં પુત્રરતનની પ્રાપ્તિ, વીરમગામ તરફ પ્રયાણ
સુપુત્રી બેન હીરાનો સ્વર્ગવાસ, વૈરાગ્ય રંગ.

શરીર સશક્ત અને તંદુરસ્ત થતાં મીલમાં જોખર તરીકેની નોકરીમાં જોડાયા. અમદાવાદમાં લાઈ શ્રી હરજીવનદાસને પોતાના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત

૧૯૬૭ ના વૈશાખ માસમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેનું શુભ નામ પ્રભુદાસ રાખવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૯૬૯ ની સાલ સુધી અમદાવાદમાં રહ્યા, ત્યાંથી સંવત ૧૯૭૦ માં પોતાના ધર્મપત્ની તથા પુત્ર-પુત્રી સાથે વીરમગામ ગયા, અને ત્યાંની એડવર્ડ મીલના મેનેજરને મળતાં તેમની જોખર તરીકે નિમણુંક થઈ. તેમની પુત્રી બેન હીરા સંવત્ ૧૯૭૨ માં જીવલેણ વ્યાધિથી ગુજરી ગઈ. બેન હીરા ઉપર હરજીવનદાસને અથાગ મોહ હતો. આવી ગુણીયલ અને સુશીલ પુત્રી ગુમાવ્યાથી તેમને સખ્ત આઘાત લાગ્યો, અને સંસારની અસારતાનું ભાન થયું. એ જ અરસામાં આચાર્યજી મહારાજશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય મુનિમહારાજ શ્રી દેવેન્દ્ર-વિજયજી મહારાજ વીરમગામ પધાર્યા હતા. તેમના સમાગમથી ભાઈશ્રી હરજીવનદાસનું ધાર્મિક પ્રવૃત્તિ તરફ વિશેષ લક્ષ્ય દોરાયું. મોજશોખ અને અમન-ચમનને બદલે વૈરાગ્યનો રંગ લાગ્યો. રાત્રિભોજન અને બાર તિથિ લીલોતરીનો ત્યાગ કર્યો. બિન પાણી પીવાનું શરૂ કરી દીધું, અને એકાસણું આય-બિલ તથા ઉપવાસ વિગેરે તપશ્ચર્યા યથાશક્તિ કરવા લાગ્યા. વળી દર પૂનમે લોચણીજીની યાત્રા કરવા જતા.

વીરમગામમાં બીજા પુત્ર ભાઈ શ્રી જયંતીલાલનો જન્મ, ગુરુદેવ મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશ અને વ્યાખ્યાનથી વધતો વૈરાગ્ય; દીક્ષાની ભાવના.

ઉપર જણાવ્યા મુજબ ભાઈ શ્રી હરજીવનદાસ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંસાર-વ્યવહાર ચલાવતા હતા. તેમના ધર્મ-

પત્ની બાઈ રતને વીરમગામમાં સંવત્ ૧૯૭૩ માં બીજા પુત્રરત્નને જન્મ આપ્યો, જેનું શુભ નામ જયંતીલાલ રાખવામાં આવ્યું. એ અરસામાં જગત્પૂજ્ય શાસ્ત્રવિશારદ્ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-રત્ન પ્રખર વિદ્વાન્ મુનિમહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પોતાના શિષ્ય-સમુદાય સાથે વિચરતા વિચરતા વીરમગામ પધાર્યા. તેઓશ્રી વ્યાખ્યાનમાં વૈરાગ્યરસ ભરપૂર સુપ્રસિદ્ધ ગ્રંથ સમરોદિત્ય ચરિત્ર વાંચતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળવા ભદ્રક પ્રકૃતિ હરજીવનદાસ હમેશાં જવા લાગ્યા, અને વ્યાખ્યાનમાં સાંભળેલી હકીકત એકાંતમા મનનપૂર્વક વિચારતા. તેમને સંસાર ઉપરથી વિરક્તિ તો અગાઉથી થઈ ચૂકી હતી, તેમાંય આવા સુવિહિત ગુરૂદેવનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળ્યો. બસ ! પછી તો પૂછવું જ શું ? હવે તો તેમના ચિત્તનો ઝોક વૈરાગ્ય તરફ વિશેષ ઢળવાં લાગ્યો. સવાર-સાંજનું પ્રતિક્રમણ, વીતરાગ પરમાત્માની પૂજા, અને સામાયિક; એ તેમનો નિત્યક્રમ થઈ ગયો, તેમણે બાકી રહેલો ધાર્મિક અભ્યાસ સામાયિકમાં ગુરૂદેવ પાસે ચાલુ કરી દીધો. વળી હમેશાં એકાસણું કરતા, તથા ચૈત્ર અને આસો માસની શાશ્વતી ઓળી ચાલુ કરી. સંવત્ ૧૯૭૩ ના પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ કરી. આ પ્રમાણે દિવસે દિવસે વૈરાગ્યની વૃદ્ધિ થતાં તેમને મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. એ હકીકત ગુરૂદેવને જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે- “ તમારી ધર્મ ઉપરની દૃઢ શ્રદ્ધા અને પ્રતિદિન વધતો વૈરાગ્ય જોઈ દીક્ષા અંગીકાર કરવાને પાત્ર છો એવી અમોને ખાત્રી થઈ છે. દીક્ષા સ્વીકારવી અને તેને પરિપૂર્ણ પાળવી એ આ

ક્ષણભંશુર જીંદગીનું ઉત્તમોત્તમ કાર્ય છે. સંસારભીડ ભવ્યા-
ત્માએ દીક્ષા લઈ તેને મન વચન અને કાયાથી પાળી આત્મ-
શ્રેય કરવું જોઈએ. પરંતુ દીક્ષા સ્વીકાર્યા અગાઉ કુટુંબની
સમ્મતિ મેળવાય તો પાછળથી કોઈને કષાય કરવાનું કારણ
ન રહે. વળી તમે પરિણીત છો, માટે તમારા પત્નીની તો
સમ્મતિ મેળવવાની ખાસ જરૂર છે. તમારી શુભ ભાવના તમારા
પત્નીને જણાવો, તથા તમારા કુટુંબીઓને પણ આ હકીકત
જણાવો. ” આ પ્રમાણે ગુરૂદેવની સલાહ મળતાં ભાઈ શ્રી
હરજીવનદાસે દીક્ષા લેવાની ભાવનાની હકીકત ઘણી જ નર-
માશથી પોતાના ધર્મપત્ની બેન રતનને જણાવી, અને તેમની
પાસેથી સમ્મતિ મેળવી લેવાનો પ્રયાસ કર્યો. બેન રતને કહ્યું
કે-“ આપની આજ્ઞા આજ સુધી કદાપિ લોપી નથી. દીક્ષા
લેવી જ હોય તો ખુશીથી લેજો, પરંતુ હાલ તુરતમાં લેવા
નહિં દઉં. ભાઈ જ્યંતી મોટે થાય, છેવટે પાંચ વરસનો થાય
ત્યાં સુધી તો સંસાર-વ્યવહારમાં રહેવું જોઈશે. માટે હાલમાં
દીક્ષા લેવા નહિં દઉં, અને સમ્મતિ પણ નહિં આપું ”
ભાઈ શ્રી હરજીવનદાસે પોતાના પત્નીને ઘણી રીતે સમજાવ્યા,
પરંતુ તેમણે સમ્મતિ ન આપવાથી તાત્કાલિક દીક્ષા લેવાનું
બંધ રહ્યું.

સજોડે સ્વીકારેલું ચતુર્થ વ્રત, અકાંઈની તપસ્યા,
સાધર્મિક વાત્સલ્ય વિગેરે ધાર્મિક કાર્યો.

મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્ય
શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજ પાસે યોગોદ્ધત્ત કરવાના
હોવાથી અને વીરમગામના શ્રી સંઘની આગ્રહભરી વિનંતિ

હોવાથી તેઓશ્રી ૧૯૭૪ ની સાલમાં પણ વીરમગામ રહ્યા, અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. ભાઈ શ્રી હરજીવનદાસે તેઓ-શ્રીની નિશ્રામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. તે નિમિત્તે તેમણે આંગી રચાવી, પૂજા ભણાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરી મળેલી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ત્યાર બાદ તેમણે ગુરૂ મહારાજ પાસે સંજોડે ચતુર્થ વ્રત ઉચ્ચર્યું. આસો માસમાં તેઓ પોતાના કુટુંબને વીરમગામમાં રાખી વઢવાણકેંપ ગયા, અને ત્યાંની મીલમાં જોબર તરીકે નોકરી સ્વીકારી. સંવત્ ૧૯૭૫ ના કારતક શુદ્ધિ પૂર્ણિમાની યાત્રા કરવા તેઓ વઢવાણકેંપથી પાલીતાણા આવ્યા, અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વરદાદાનાં દર્શન-પૂજન કરી પરમ આહલાહ પામ્યા. એજ રાત્રિએ વીરમગામમાં તેમના ધર્મપત્ની જેન રતને સ્વપ્નમાં મુનિરાજને દીઠા. મુનિ-રાજે જેન રતનને ઉપદેશ આપી ચતુર્થવ્રતની બાધા આપી.

જેન રતને અનુભવેલો ચમત્કાર, પરોક્ષ વાણી, તમારાસ્વામીને દીક્ષા લેતાં કેમ અટકાવો છો ?

હરજીવનદાસ સિદ્ધાચલજીની યાત્રા કરી વીરમગામ તરફ આવતા હતા, એ જ દિવસે તેમના ધર્મપત્ની જેન રતને વાણીનું બેઠું ભરીને આવતાં માર્ગમાં સાંભળ્યું કે “ તમે તમારા સ્વામીને દીક્ષા લેતાં શા માટે રોકો છો ? તેમને દીક્ષા લેવાની સંમતિ આપો. ” આવા સ્પષ્ટ શબ્દો સાંભળી જેન રતન ઉભા રહી ગયા અને આ વચ્ચે મને કોણ કહે છે ? તે જાણવા ચારે તરફ જોયું, પરંતુ કોઈ પુરૂષ

કે સ્ત્રી દીઠી નહિં જેથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા બેન રતન ઘેર આવ્યા. તેઓ ઘરના કામકાજમાં ગુંથાયા; પરંતુ ચિત્ત તો પેલી પરોક્ષ સાંભળેલી વાણીની વિચારણામાં જ અટવાયું હતું. “કોઈ માણસ તો હતું નહિ, ત્યારે શું કોઈ દેવે મને સંભળાવ્યું હશે? શું મારે મારા પતિને દીક્ષા લેવાની સમ્મતિ આપવી?” આવી રીતે ચિત્તની ગડમથલમાં રોકાયા હતા, તેવામાં શ્રી હરજીવનદાસ સિદ્ધાચળજીની યાત્રા કરી વીરમગામ આવ્યા અને ઘેર આવી સ્વસ્થ ચિત્તે બેઠા ત્યારે તેમના સુશીલ પત્ની બેન રતને પાછળ બનેલી ચમત્કારિક ઘટના વિગતવાર કહી સંભળાવી.

ભાઈશ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની પત્ની પાસેથી
તથા કુટુંબીઓ પાસેથી મેળવેલી સમ્મતિ.

પોતાના સુશીલ અને સરલ-સ્વભાવી પત્ની બાઈ રતને કહેલી હકીકત સાંભળી ભાઈશ્રી હરજીવનદાસે કહ્યું કે “આ પરોક્ષ વાણીથી મને તો જણાય છે કે, શાસનદેવે મને દીક્ષા લેવાનો અવસર જણાવ્યો છે અને તમોને તેની સમ્મતિ આપવાની પ્રેરણા કરી છે. સંસાર ઉપરથી માફ ચિત્ત ઉઠી ગયું છે. માટે તમે રાજીખુશીથી રજા આપો તો માફ આત્મ-શ્રેય સાધું.” હરજીવનદાસે આવી રીતે ઘણા પ્રયાસે પોતાના પત્નીને સમજાવી દીક્ષા અંગેની તેમની સમ્મતિ મેળવી. વળી પોતાના માતૃશ્રી વિગેરે કુટુંબીઓ પાસેથી પણ સમ્મતિ મેળવી લીધી.

આ વખતે મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ વીરમગામથી વિહાર કરી પોતાના શિષ્ય-સમુદાય સાથે જોટાણા પધાર્યા હતા, હર્ષિત હૃદયવાળા હરજીવનદાસ જોટાણા પહોંચ્યા અને પોતાની પત્ની તથા કુટુંબીઓ તરફથી દીક્ષાની સમ્મતિ મળેલી હોવાથી તાત્કાલિક દીક્ષા આપવા આગ્રહપૂર્વક નમ્ર વિનંતિ કરી. શુક્ર મહારાજે દીક્ષાનું મુદૂર્ત કાઢ્યું તો માગશર શુદ્ધિ ૧૦ શુક્રવારના રોજ આવ્યું. હરજીવનદાસે પોતાના પત્ની તથા કુટુંબીઓને આ નિર્ણય જણાવ્યો; જેથી દીક્ષા-મહોત્સવના શુભ પ્રસંગે તેમના પત્ની જહેન રતન, પુત્રો-ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલ, માતુશ્રી બાઈ મોંઘી, માસીબા બાઈ મૂળી, મામાના દિકરા ભાઈ ત્રિભોવનદાસ તથા માતુ-શ્રીના મામા ભાઈ દેવકરણ નથુભાઈ વિગેરે હાજર થયા.

જોટાણામાં ભાઈશ્રી હરજીવનદાસે સ્વીકારેલી
ભાગવતી દીક્ષા, તેમનું પાડલું મુનિશ્રી
કંચનવિજયજી નામ.


એજ દિવસે એટલે માગશર શુદ્ધિ ૧૦ ના રોજ મુંદરડાના રહીશ શા હરગોવન ઉમેદરામના ધર્મપત્ની જહેન પરસન બાઈને તેમના કુટુંબીઓની સમ્મતિથી મુનિરાજ શ્રી ભક્તિ-વિજયજી મહારાજ પાસે જોટાણામાં દીક્ષા લેવાની હતી. જેથી તે નિમિત્તે જહેન પરસનના દિયર શેઠ અમથાલાલ તરફથી જોટાણામાં ધામધૂમથી અઠાઈ-મહોત્સવ શરૂ થયો, તથા તેમના તરફથી આઠે દિવસ નવકારશી નોંધાવવામાં આવી.

ભાઈ શ્રી હરજીવનદાસનો દીક્ષા-મહોત્સવનો વરઘોડો માગશર શુદ્ધિ નવમી તથા દશમી એમ બન્ને દિવસે ઠાઠ-માઠથી ચડાવવામાં આવ્યો. દીક્ષાના ઉપકરણની છાબ તેમના ધર્મપત્ની સૌભાગ્યવંતા ખેડેન રતનબાઈએ લીધી હતી. હરજીવનદાસ તથા તેમના પત્નીએ સંવત ૧૯૭૪ ની સાલમાં વીરમગામમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચતુર્થવ્રતની બાધા લીધી હતી, પરંતુ નાણુ મંડાવી નહોતી જેથી દીક્ષા લીધા અગાઉ મંડાવેલી નાણુ સમક્ષ ભાઈ શ્રી હરજીવનદાસ તથા તેમના ધર્મપત્ની રતન ખેડેને મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક ચતુર્થવ્રત ઉચ્ચયું. ત્યારબાદ દીક્ષાની વિધિ શરૂ થઈ અને વિધિ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજે તેમને સંવત ૧૯૭૫ ના માગશર શુદ્ધિ ૧૦ શુક્રવારના શુભ ચોઘડીએ ભાગવતી દીક્ષા આપી પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા, તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂદેવે જ્યારે તેમને રજેહરણ આપ્યું ત્યારે તેમને વચનાતીત આહવાદ થયો અને ઉછળી ઉછળીને નાર્યા. ભાઈ શ્રી હરજીવનદાસ દીક્ષા લેવા જતા હતા, ત્યારે તેમના માતૃશ્રી સૌભાગ્યવંતા ખેડેન મેઘી બાઈએ ચતુર્વિધ સંઘ વચ્ચે દીક્ષા લેવાની રજા આપી સ્વહસ્તે ચાંદલો કરી આશીર્વાદ આપ્યો હતો. ખરી પુત્રવત્સલ માતા એજ કહેવાય કે જે પોતાના પુત્રનું હિત ઇચ્છે. આત્મિક ઉન્નતિ તરફ સંચરતા પોતાના પુત્રને જોઈ મેઘીબાઈ બહુ જ ખુશી થયા. આવી માતાઓ જગતમાં વિરલ હોય છે, ધન્ય છે એવી માતાઓને. આ ચિરસ્મરણીય શુભ પ્રસંગની યાદગીરી નિમિત્તે જોટાણાના સંઘે તે દિવસે પાખી પાળવાનો

ઠરાવ કર્યો હતો, ત્યારથી અવિચ્છિન્નપણે આજ-સુધી માગશર શુદ્ધિ ૧૦ ને દિવસે જોટાણામાં પાખી બરાબર પળાય છે.

મુનિરાજશ્રી ભકિતવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવન-દાસને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કંચનવિજયજી રાખ્યું; એજ સમયે તેઓશ્રીએ બાઈ પરસનને પણ દીક્ષા આપી, તેમનું નામ સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી રાખવામાં આવ્યું, અને તેમને સાધ્વીજી શ્રી ચન્દ્રશ્રીજીના શિષ્યા તરીકે ચતુર્વિંધ સંઘ વચ્ચે જાહેર કર્યા.

મુનિરાજ શ્રી ભકિતવિજયજી મહારાજ એ રાત્રે પોતાના શિષ્ય-પરિવાર તથા નવદીક્ષિત મુનિ શ્રી કંચનવિજયજી સાથે ગામ બહાર આવેલા જીનમાં રહ્યા, અને વળતે દિવસે ધામ-ધૂમથી જોટાણા ગામમાં પ્રવેશ કર્યો. દીક્ષાને દિવસે એટલે માગશર શુદ્ધિ ૧૦ ના રોજ મુનિશ્રી કંચનવિજયજીએ ચોવિ-હારે ઉપવાસ કર્યો હતો, અને વળતે દિવસે મૌન એકાદશીના રોજ એકલા ચોખાથી આયંબિલ કર્યું હતું. જોટાણામાં ત્રણ દિવસ રોકાઈ ગુરૂ મહારાજ સાથે ત્યાંથી વિહાર કરી, કટોસણ થઈ રાંતેજ તીર્થની યાત્રા કરી શ્રી શંખેશ્વર પધાર્યા; અને પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર પોર્શ્વનાથ સ્વામીના દર્શન કરી આત્મોદ્ધાસ પામ્યા.



મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે શ્રી શંખેશ્વરજીથી વિહાર કરી સમી આવ્યા, અને ત્યાં વડી દીક્ષાના યોગ-વહન કર્યા. સમીમાં

તેમને વડી દીક્ષા આપવાની હોવાથી એ શુભ પ્રસંગે તેઓ-શ્રીના સંસારી કુટુંબીઓ આવ્યા. મુનિરાજશ્રી કંચનવિજયજીને સંવત ૧૯૭૫ના મહા શુદ્ધિ પ ના રોજ આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી અને શ્રી સંઘ સમક્ષ તેઓશ્રીને મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ શુભ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી, અને સમીના સંઘમાં અતિશય ઉત્સાહ ફેલાયો હતો.

સમીથી પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી ઝીંઝુવાડા થઈ અમદાવાદ આવ્યા, અને ત્યાં એક મહિનો સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી કપડવંજ પધાર્યા. કપડવંજમાં આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ ના અશાઠ શુદ્ધિ બીજના રોજ મુનિરાજશ્રી ભક્તિ-વિજયજી મહારાજને ગણી પદવી અને અશાઠ શુદ્ધિ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. આ માંગલિક પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિ-સ્નાત્ર વિગેરે અનેક શુભ કાર્યો થયાં હતાં.

મુનિરાજશ્રી કંચનવિજયજી મહારાજે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી વિગેરે મુનિરાજો સાથે સંવત ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ કપડવંજમાં કર્યું. ચોમાસી ચૌદશ પહેલાં કપડવંજ પાસેના આત્રોલી ગામમાં મુહપત્તિનું પડિ-લેહણ કર્યું હતું, જેથી આત્રોલીના સંઘની વિનતિથી ગુરૂ મહારાજે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા મુનિરાજ શ્રી કંચન-વિજયજી અને અકલંકવિજયજીને આત્રોલી મોકલ્યા હતા.

પર્યુષણમાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું, તેમના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયા. પર્યુષણ પૂર્ણ થયા બાદ તેઓશ્રી પાછા કપડવંજ આવ્યા, અને ત્યાં ગુરૂ મહારાજ સાથે ચતુર્માસ પૂર્ણ કર્યું.

ચોમાસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિરાજે સાથે કપડવંજથી વિહાર કર્યો અને મહુધા, ખેડા, માતર, અમદાવાદ, વિગેરે શહેરો તથા ગામોમાં વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા. સંવત્ ૧૯૭૬નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું. આ ચોમાસામાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ઉત્તરાધ્યયનના યોગ વહન કર્યા, પર્યુષણમાં ૧૬ ઉપવાસની તપસ્યા કરી, અને ગુરુ મહારાજ પાસે જીવ-વિચારાદિ ચાર પ્રકરણ તથા ચાર કર્મગ્રંથનો અભ્યાસ કર્યો, તેમને ધાર્મિક ઉપરાંત સંસ્કૃત અભ્યાસ કરવાની પણ તીવ્ર ઇચ્છા થઈ, અને એ હકીકત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂદેવ ઘણા જ ખુશી થયા, અને સંમતિ આપી જેથી તેમણે આસો વદિ ૧૩ ના રોજ પંડિત ત્રિભુવનદાસ અમરચંદ પાસે સારસ્વત વ્યાકરણ ભણવાનો પ્રારંભ કર્યો. ચોમાસા બાદ પાલીતાણાથી ગુરૂ-મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો અને ગારીયાધાર, કુંડલા, ઉના, દીવ થઈ શ્રી અન્નરા પાર્શ્વનાથ સ્વામીની યાત્રા કરી. ત્યાંથી પ્રભાસપાટણ, વેરાવળ, અને માંગરોળ થઈ જુનાગઢ આવ્યા. ત્યાં શ્રી ગીરનારજીની યાત્રા કરી પોરબંદર આવી થોડા દિવસની સ્થિરતા કરી, અહીં બ્રાહ્મણોની સંસ્કૃત પાઠશાળા ઉપાશ્રયથી એક માઈલ દૂર છે, ત્યાં વૈશાખ માસના સખત તાપમાં મુનિરાજશ્રી કંચનવિજયજી સંસ્કૃતનો અભ્યાસ

કરવા જતા, અને સારસ્વત વ્યાકરણના કારક સુધીનો અભ્યાસ કર્યો. પોરબંદરથી વિહાર કરી માંગરોળ પધાર્યો, અને ગુરૂ-મહારાજ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૭ નું ચતુર્માસ માંગરોળમાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ પર્યુષણમાં અઠાઈની તપસ્યા કરી, અભ્યાસમાં સારસ્વત વ્યાકરણ પૂર્વાર્ધ પૂર્ણ કર્યું, અને સિદ્ધાંત ચંદ્રિકા ઉત્તરાર્ધ શરૂ કર્યું.

માંગરોળમાં ગુરૂદેવ પંન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી શેઠ મકનજી કાનજી તરફથી ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની માળ પહેરાવવાની વિધિ પૂર્ણ થતાં માંગરોળથી વિહાર કરી પ્રભાસપાટણ વિગેરે તીર્થોની યાત્રા કરી જામનગર આવ્યા, ત્યાંથી રાણપુર થઈ વઢવાણ શહેર પધાર્યો, અને ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૮ નું ચતુર્માસ વઢવાણ શહેરમાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ દીક્ષા લીધા બાદ થોડાજ માસમાં તેમના સંસારી ધર્મપત્ની રતનબેન ગુજરી જવાથી તેમના પુત્રો ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલની સાર-સંભાળ તેમના માતા-પિતા તથા લઘુભંધુ ભાઈ નાનાલાલ કરતા હતા. મુનિરાજ શ્રી કંચનવિજયજીનું ચતુર્માસ વઢવાણ થયું છે, એવા સમાચાર મળતાં તેમના સંસારી માતૃશ્રી એ બન્ને પુત્રોને લઈને વંદન કરવા વઢવાણ આવ્યા, વળી તેમના સંસારી કુળબા લહેરીબેન પણ તેમની સાથે વંદન કરવા આવ્યા હતા, તેમણે મુનિરાજશ્રી કંચનવિજયજી પાસે ચતુર્થ-વ્રતનું પરચ-ખાણ લીધું. આ ચતુર્માસમાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ ગુરૂ મહારાજ પાસે આચારાંગના યોગ વહન કર્યા, તથા પર્યુષણમાં અઠાઈની તપશ્ચર્યા કરી.

શિવપુરીમાં આચાર્યજી મહારાજશ્રી વિજય-
ધર્મસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ,
ગુરુભક્તિનો પ્રભાવ.

સંવત ૧૯૭૮ ના ભાદરવા શુદ્ધિ ૧૪ના રોજ શિવપુરીથી ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર તારથી આવ્યા. પરમોપકારી ગુરુદેવનો વિરહ થવાથી પંન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ, તથા મુનિરાજ શ્રી કંચનવિજયજી વિગેરે મુનિવર્યોને સખત આઘાત લાગ્યો. વઢવાણના શ્રી સંઘમાં ગમગીની ફેલાઈ ગઈ, અને ચતુર્વિધ શ્રીસંઘે સજ્જન નેત્રે દેવવંદન કર્યું.

આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યારથી આજ સુધી તેઓશ્રીના નામની એક નવકારવાળી અવિચ્છિન્નપણે મુનિરાજ શ્રી કંચનવિજયજી ગણે છે. મુનિરાજ શ્રી કંચનવિજયજી કહે છે કે, મને ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાધુપણના વેષે સ્વપ્નમાં કોઈ કોઈ વાર દર્શન દે છે, અને મને સ્વપ્નમાં તેઓશ્રી જે જે કહે છે તે મુજબ જ બને છે; જેથી તેઓશ્રી ઉચ્ચ ગતિના દેવ થયા છે. એવી મારી દઢ માન્યતા છે.

ચોમાસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વઢવાણથી વિહાર કરી લીંબડી આવ્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ચન્દ્રિકા વ્યાકરણ પૂર્ણ કર્યું હતું, જેથી હવે તેમને

સંસ્કૃત કાવ્યોનો અભ્યાસ કરવાની જરૂર હતી; જેથી ગુરુ મહારાજની આજ્ઞાથી તેઓ મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી સાથે લીંબડીથી વિહાર કરી વીરમગામ આવ્યા, અને ત્યાંના પંડિત પાસે રઘુવંશ કાવ્યનો અભ્યાસ શરૂ કર્યો. ચૈત્રી ઓળી એક ધાનની વિધિપૂર્વક કરી, પારણું કર્યા બાદ તબિયત એકાએક લથડી ગઈ, પરંતુ દવા ઉપચારથી સાફ થઈ ગયું. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ વિગેરે ઠાણાઓએ લીંબડીથી પાલીતાણા તરફ વિહાર કર્યો હતો, તેઓશ્રી શ્રી શત્રુજયની નવાણું યાત્રા કરી પાલીતાણાથી વિહાર કરી વીરમગામ પધાર્યા. અહીં ગુરુદેવનો મેળાપ થતાં તેઓશ્રીના દર્શન-વંદન કરી મુનિરાજ શ્રી કંચનવિજયજી પરમ આનંદ પામ્યા. વીરમગામથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને સમી પધાર્યા. સંવત્ ૧૯૭૯નું ચાતુર્માસ સમીમાં કર્યું. અહીંની જૈન પાઠશાલામાં ધાર્મિક માસ્તરની ગેકડાજરી હોવાથી વિદ્યાર્થીઓનો ધાર્મિક અભ્યાસ અટકી પડ્યો હતો, જેથી ગુરુ મહારાજની આજ્ઞા થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ ચાલુ કરાવ્યો. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં તેઓશ્રીએ અકાઈની તપસ્યા કરી, તથા આસો માસની ઓળી વિધિપૂર્વક એક ધાનની કરી. ચાતુર્માસ પૂર્ણ થતાં સમીથી વિહાર કરી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુર આવ્યા. ત્યાંથી ભાલેર, કુવાળા, દીવોદર, થરા, ઉણ અને સમી થઈ શ્રી શંખેશ્વરજી આવ્યા. ત્યાં નવપદજીની ઓળી કરી, ત્યાંથી વિહાર કરી કુવારદ, શંખલપુર અને માંડલ થઈ વીરમગામ પધાર્યા. સંવત્ ૧૯૮૦ નું ચાતુર્માસ વીરમગામમાં કર્યું. અહીં

પંડિત પાસે કિરાત મહાકાવ્ય, ટીકા સહિતનો અભ્યાસ કર્યો, ગુરૂમહારાજ પાસે કલ્પસૂત્રના યોગ વહન કર્યા, તથા પથ્યુષણ પર્વમાં ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી. આસો માસમાં વિધિ-પૂર્વક એક ધાનની ઓળી કરી. આ અરસામાં ભાવનગરથી મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજના સંસારી સંખંધી પરમ વૈરાગી ભાવસાર હરજીવનદાસ વનમાળીદાસ લોંબડીયા દીક્ષા લેવા વીરમગામ આવ્યા, અને પંન્યાસજી મહારાજને પોતાની શુભ ભાવના જણાવતાં તેઓશ્રીએ અનુ-મતિ આપી. સંવત્ ૧૯૮૧ ના કારતક વદિ ૩ ના રોજ પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવન-દાસને ભાગવતી દીક્ષા આપી, અને તેનું નામ મુનિ શ્રી કલ્યાણવિજયજી રાખી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા.

ત્યાર બાદ પોતાના નૂતન શિષ્યરત્ન તથા ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વીરમગામથી વિહાર કર્યો, અને વિઠલાપુર, વણોદ, પંચાસર, શંખેશ્વર, ઝીંજુવાડા, ધ્રાંગધ્રા, અને રાણપુર વિગેરે નાના-મોટા શહેરો અને ગામોમાં વિચરતા વિચરતા પાલીતાણા આવ્યા. સંવત્ ૧૯૮૧ ના ફાગણ શુદ્ધ પાંચમના રોજ ગુરૂદેવ પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજે ગિરિરાજ ઉપર મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિ-રાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. પાલીતાણાથી વિહાર કરી શિહોર વિગેરે સ્થળે થઈ ભાવનગર પધાર્યા, અને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરૂદેવ વિગેરે બહોળા સાધુ-પરિવાર સાથે સંવત્ ૧૯૮૧ નું ચાતુર્માસ

ભાવનગરમા મારવાડીના વંડામાં ક્યું. આ ચોમાસામાં તેઓશ્રીએ જેઠાલાલ શાસ્ત્રી તથા જગજીવનદાસ પંડિત પાસે માઘ કાવ્યનો અભ્યાસ કર્યો. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને વડવાના શ્રીસંઘે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માટે વડવાના ઉપાશ્રયે મુનિરાજ શ્રી કંચનવિજયજીને મોકલવા વિનંતિ કરી, જેથી ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડવાના ઉપાશ્રયે પધાર્યા, અને સુખોધિકા ટીકા સહિત શ્રી કલ્પસૂત્રનું વાંચન ક્યું. વડવામાં પર્યુષણ નિમિત્તે અકાઈ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. તપ-સ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ત્રિજીવનદાસ લાધા-ભાઈ તરફથી પારણાનો વરઘોડો ઘણાજ આડંબર સાથે નીકળ્યો, જેમાં સ્ટેટનો હાથી પણ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુનિરાજ શ્રી કંચનવિજયજી પાછા મારવાડીને વંડે પધાર્યા. આસો માસની ઓળીમાં છ ઉપવાસ ઉપર બાકીના ત્રણ દિવસ એક ધાનના આયંબિલ કરી વિધિપૂર્વક ઓળીની આરાધના કરી.

સંવત્ ૧૯૮૧ ના ચોમાસા બાદ મુનિરાજ શ્રી કંચન-વિજયજીને તીર્થોધિરાજ શ્રી શત્રુજયની નવાણું યાત્રા કરવાની શુભ ભાવના થતાં એ હકીકત તેઓશ્રીએ ગુરૂમહારાજને જણાવી. ગુરૂદેવે તેની અનુમતિ આપી, જેથી તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે ભાવનગરથી વિહાર કરી પાલી-તાણાં પધાર્યા; અને હમેશાં એકાસણે વિધિપૂર્વક નવાણું યાત્રા શરૂ કરી દીધી. ચોવિહારો છઠ્ઠું કરી સાત યાત્રા કરી, વળી સાત છઠ્ઠું અને બે અઠ્ઠમ કરીને યાત્રા કરી. આ અરસામાં તેઓશ્રીના સંસારી સંબંધી ભાવસાર ઓઘડભાઈ હરજી વૈરાગ્ય

આવતાં દેવગણા મુકામે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરવા આવ્યા, અને પોતાને દીક્ષા આપી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કરવા વિનંતિ કરી. જેથી ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિરાજ શ્રી કંચનવિજયજીને દેવગણા આવવા જણાવ્યું. ગુરૂમહારાજની આજ્ઞા થતાં તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાથી વિહાર કરી દેવગણા આવ્યા. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૮૨ ના ફાગણ શુદ્ધ ત્રીજના રોજ ભાવસાર ઓઘડ-ભાઈ હરજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી આણંદવિજયજી રાખ્યું, અને તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષાવિધિ પૂર્ણ થતાં ગુરૂદેવની આજ્ઞા મેળવી મુનિરાજ શ્રી કંચનવિજયજી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે દેવગણાથી વિહાર કરી પાછા પાલીતાણા આવ્યા, અને અવશેષ રહેલી નવાણું યાત્રા પૂર્ણ કરી. આ વખતે દોઢ, ત્રણ, છ, અને બાર ગાઉની પણ પ્રદક્ષિણાપૂર્વક યાત્રા કરી; વળી તેઓશ્રીએ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં શ્રી વર્ધમાન તપની ઓળીની શરૂઆત કરી દીધી. નવાણું યાત્રા પૂર્ણ થતાં તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ગુરૂદેવનાં વંદન-દર્શન કરી પરમ આનંદ પામ્યા. ભાવનગરમાં ચૈત્રી ઓળી એક ધાનની વિધિપૂર્વક કરી.

ત્યાર બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે ભાવનગરથી વિહાર કરી રાણપુર, ચુડા, વિગેરે ગામોમાં વિચરતા વિચરતા

વઢવાણ આવ્યા. અહીં ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિ શ્રી આણુંદવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. વઢવાણથી ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી પાટડી ગયા, ત્યાંથી શંખેશ્વરજી થઈ સમી પધાર્યા. સમીના શ્રીસંઘે ચતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી પરંતુ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ચતુર્માસ માટે પાટડીના શ્રીસંઘની વિનંતિ સ્વીકારેલી હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને સમીમાં ચતુર્માસ માટે રોકાવા આજ્ઞા કરી, અને પોતે શિષ્ય-પરિવાર સાથે વિહાર કરી પાટડી પધાર્યા. ગુરૂદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી તથા આણુંદવિજયજી સાથે સંવત્ ૧૯૮૨ ની સાલનું ચતુર્માસ સમીમાં કર્યું. અહીં મહાજનના ચોપડામાં કેટલોક ગોટાળો ચાલ્યો આવતો હતો, તે તેઓશ્રીએ શ્રાવકોને સદુપદેશ આપીને તથા પ્રયાસ કરીને દૂર કરાવ્યો. ભાદરવા શુદ્ધ ૧૪ ના રોજ ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજય-ધર્મસૂરીશ્વરજી મહારાજની જયંતી ધામધૂમથી વરઘોડા સાથે ઉજવી. આસો માસની ઓળી એક ધાનના આયંબિલથી વિધિપૂર્વક કરી.

આ સમયે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પાટડીમાં ચતુર્માસ કર્યું હતું. ચોમાસા બાદ તેઓશ્રીએ પોતાના શિષ્ય-પરિવાર સાથે પાટડીથી વિહાર કર્યો, અને વીરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી સમી પધાર્યા. આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંદે કચ્છ-ગીરનારનો છરી પાળતો સંઘ

કાઢયો હતો, અને તે શ્રી શંખેશ્વરજી આવવાનો હોવાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરજી આવ્યા, અને સંઘ સાથે પંન્યાસર, દસાડા, માંડલ, ઝીંઝુવાડા થઈ ધ્રાંગધ્રા આવ્યા. ત્યાંથી કચ્છ તરફ પ્રયાણ કર્યું. કચ્છમાં નાના-મોટા શહેરો અને ગામોમાં વિચરતા વિચરતા સંઘ સાથે શ્રી ભદ્રેશ્વરજી આવ્યા, અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થની અપૂર્વ યાત્રા કરી અનહદ આત્મિક ઉદ્ધાસ પામ્યા. સંઘ સાથે કચ્છની યાત્રા કરી વિહાર કરતા કરતા રાજકોટ, મેરણી, વાંકાનેર વિગેરે સ્થળે થઈ જુનાગઢ આવ્યા, અને શ્રી ગીરનારજીની યાત્રા કરી. આ વખતે મુનિરાજ શ્રી કંચનવિજયજીનાં સંસારી માતૃશ્રી મોંઘીખેડેન ગીરનારજીની યાત્રા કરવા તથા મુનિરાજેને વંદન કરવા જુનાગઢ આવ્યા. તેમણે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી વૈશાખ શુદ્ધિ ૩ થી વરસીતપ શરૂ કર્યો. મુનિરાજ શ્રી કંચનવિજયજી ગુરુદેવની આજ્ઞાથી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી તથા આણંદવિજયજી સાથે જુનાગઢથી વિહાર કરી વીરમગામ પધાર્યા, અને વીરમગામના સંઘની આગ્રહલરી વિનતિથી તેઓશ્રીએ સંવત્ ૧૯૮૩ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે જુનાગઢથી વિહાર કરી વઢવાણકાંપ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહલરી વિનતિથી તેઓશ્રી વઢવાણકાંપમાં ચતુર્માસ રહ્યા. વીરમગામમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત પાસે નૈષધીય મહાકાવ્યના પાંચ સર્ગ કર્યા, અને આસો માસમાં એક ધાનની ઝોળી વિધિપૂર્વક કરી. વળી તેઓશ્રીના શિષ્ય મુનિ શ્રી આણંદવિજયજીએ પર્યુ-

બણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિ-
વિજયજી મહારાજ ચતુર્માસ પૂર્ણ થતાં પોતાના શિષ્ય-પરિ-
વાર સાથે વઢવાણકાંપથી વિહાર કરી વીરમગામ થઈ શ્રી
શંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાં થોડા દિવસ
સ્થિરતા કર્યા બાદ સમી, શંખેશ્વરજી, ઝીંઝુવાડા થઈ પાછા
વીરમગામ પધાર્યા.

ત્યાર બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે
મુનિવર્યો સાથે વીરમગામથી વિહાર કર્યો. અને ભોયણીજી
તથા શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી સમી થઈ રાધનપુર
પધાર્યા. સંવત્ ૧૯૮૪ નું ચતુર્માસ રાધનપુરમાં કર્યું.
તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી જેઠ માસમાં
રાધનપુરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે શ્રીસંઘ તરફથી અઠ્ઠાઈ
મહોત્સવ થયો. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ રાધનપુરમાં
ગુરુદેવ પાસે શ્રી નંદીસૂત્ર તથા મહાનિશીથસૂત્રના જોગ વહન
કર્યા, પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, તથા આસો
માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. ચોમાસા બાદ
ગુરુમહારાજ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુરથી વિહાર કરી
સમી આવ્યા. આ અરસામાં રાધનપુરથી શેઠ જીવતલાલ
પ્રતાપશી તરફથી શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ નીક-
ળવાનો હોવાથી, તેમના તરફથી સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી
આવવા આગ્રહભરી વિનંતિ થતાં સમીથી વિહાર કરી રાધન-
પુર પધાર્યા. અને સંઘ સાથે વિચરતા વિચરતા મહા માસમાં
પાલીતાણા પહોંચ્યા. અહીં શંખલપુરના ભાવસાર જેઠાલાલ
ભવાનદાસ માતા-પિતાની અનુમતિ લઈ વૈરાગ્યથી દીક્ષા અંગી-
કાર કરવા આવ્યા. દીક્ષાનું નક્કી થતાં શેઠ જીવતલાલ પ્રતા-

પશી તરફથી હાથી સહિત ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. અને ભાવસાર જેઠાલાલ ભગવાનદાસને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મહા વદિ ૧૧ ના રોજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી જગતવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કર્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ફાગણ વદિ ૮ ના રોજ શ્રી સિદ્ધક્ષેત્રમાં વરસીતપ શરૂ કર્યો, ત્યાર બાદ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને ભાવનગર ચૈત્રી ઓળી કરી ત્યાંથી વિહાર કરી અમદાવાદ શાહપુર પધાર્યા. અહીં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે સરસપુરના સંઘે આવી ચોમાસા માટે આગ્રહભરી વિનંતિ કરી, પરંતુ પોતાનું ચતુર્માસ શાહપુરમાં નક્કી થયેલું હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને મુનિ શ્રી જગતવિજયજી સાથે સરસપુર ચોમાસા માટે મોકલ્યા. તેઓશ્રીએ સંવત્ ૧૯૮૫ નું ચતુર્માસ અમદાવાદ-સરસપુરમાં કર્યું. સરસપુરમાં તેઓશ્રીના સદ્ગુપદેશથી પીસ્તાલીશ આગમની તપસ્યા થઈ, જેનો લાભ ઘણા ભાઈ-બહેનોએ લીધો. પર્યુષણ નિમિત્તે અઠ્યાઈ મહોત્સવ થયો અને શેઠ નગીનદાસ કીલાચંદ તરફથી પીસ્તાલીશ આગમનો વરઘોડો ઘણાજ ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યો; જેમાં ગુરુમહારાજ ઉપરાંત અમદાવાદમાં બિરાજતા મુનિરાજે, સાધ્વીજી મહારાજે, તથા સંખ્યાબંધ શ્રાવકશ્રાવિકાઓ સામેલ થયા.

ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ ગુરુદેવની આજ્ઞાથી પોતાના શિષ્ય મુનિ શ્રી જગતવિજયજી સાથે અમદાવાદ-સરસપુરથી વિહાર કર્યો, અને શહેરો તથા ગામોમાં

વિચરતા વિચરતા ભાવનગર થઈ કોળીયાક પધાર્યા. ત્યાં ચૈત્રીઓળી કરી તથા દેવ વંદાવી ત્યાંથી વિહાર કરી પાલી-તાણા આવ્યા. અહીં અક્ષય તૃતીયાના રોજ વરસીતપનું પારણું કરી પાલીતાણાથી વિહાર કરી વિચરતા વિચરતા વીરમગામ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત્ ૧૯૮૬ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. તેઓશ્રી સાથે મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી, આણંદવિજયજી તથા જગતવિજયજી ચોમાસું રહ્યા હતા. ચતુર્માસમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત જટાશંકર પાસે શાલિભદ્ર ચરિત્ર તથા યોગશાસ્ત્ર ટીકાસહિતનો અભ્યાસ કર્યો. વળી તેઓશ્રીના સદુપદેશથી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા ખેડેનોએ પીસ્તાલીશ આગમ અને અષ્ટ મહાસિદ્ધિનો તપ વિધિપૂર્વક કર્યો, તે નિમિત્તે ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. તેઓશ્રીએ આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. પોતાને પંડિત પાસે અભ્યાસ ચાલતો હોવાથી વીરમગામમાં રોકાયા, અને ચૈત્રી ઓળી વીરમગામમાં કરી તથા ચૈત્રીપૂનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભોયણી તીર્થની યાત્રા કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા.

મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહેસાણામાં શ્રી સૂયગડાંગ સૂત્રના જોગમાં પ્રવેશ કર્યો. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ગુરુદેવની આજ્ઞાથી પોતાના શિષ્ય મુનિશ્રી જગતવિજયજી સાથે વિહાર કરી પ્રથમ અસાડ માસમાં અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળામાં ઉતર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે

કાળુશાની પોળને ઉપાશ્રયે ગયા. આ વખતે રાધનપુરવાળા પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ હાજપટેલની પોળમાં પગથીયાને ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની પાસે મુનિરાજ શ્રી કંચનવિજયજી હંમેશાં સવાર-સાંજ જતા, અને તેઓશ્રી પાસે સૂયગડાંગના અધુરા રહેલા જોગ પૂર્ણ કર્યા. ત્યારબાદ મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે તેઓશ્રી કાળુશાની પોળથી હુણુસાવાડાના ઉપાશ્રયે પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૮૭ નું ચતુર્માસ અમદાવાદ-હુણુસાવાડામાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીના સદુપદેશથી હુણુસાવાડામાં તપસ્યા, પૂજા, પ્રભાવના તથા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. તેઓશ્રીએ આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી, તથા મુનિશ્રી પ્રેમવિજયજીને દશવૈકાલિકના જોગ શરૂ કરાવ્યા. ચતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ-હુણુસાવાડાથી વિહાર કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુદેવનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. મહેસાણાથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી વીરમગામ પધાર્યા. અહીંથી ગુરુમહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે સાલડી તરફ વિહાર કર્યો, પરંતુ મુનિરાજ શ્રી કંચનવિજયજીને પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ વધારવાની ઇચ્છા હોવાથી તેઓશ્રી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે મુનિવર્યો સાથે વિરમગામ રોકાયા. ત્યાં કેટલોક વખત ગાળી તેઓ મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી, ભુવનવિજયજી, પ્રબોધવિજયજી, આણંદવિજયજી અને જગતવિજયજી સાથે વિહાર કરી અમદાવાદ, ખંભાત, વત્રા, જંબુસર, આમોદ, ભરૂચ થઈ રાંદેર આવ્યા. અહીં ગુરુદેવ

પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે અગાઉથી પધાર્યા હતા, તેઓશ્રીનાં દર્શન-વંદન કરી પરમ આનંદ પામ્યા. રાંદેરથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સુરત પધાર્યા, અને સંવત્ ૧૯૮૮ નું ચતુર્માસ સુરતમાં નેમુભાઈની વાડીમાં કર્યું. પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માટે પધારવા વડાચૌટાના સંઘે વિનતિ કરવાથી ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડાચૌટાના ઉપાશ્રયે આવ્યા. તેઓશ્રીના પધારવાથી વડાચૌટામાં તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી આસો માસમાં વડાચૌટાના ઉપાશ્રયે નાણુ મંડાવી પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજ પાસે ૧૮ જણુએ સળેડે ચતુર્થ-વ્રત અંગીકાર કર્યું, અને એજ વખતે ખીજા પણુ ઘણા ભાઈ-બહેનોએ જીદા જીદા વ્રત ઉચ્ચર્યા. ગુરુદેવ પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજના સદુપદેશથી સુરતમાં ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની હંમેશાં સવાર-સાંજની ક્રિયા ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી કરાવતા હતા. આ ચતુર્માસમાં તેઓશ્રીએ ગુરૂ મહારાજ પાસે સ્થાનાંગ તથા જ્ઞાતાસૂત્ર વિગેરેના જોગ વહન કર્યા.

ચોમાસા બાદ સુરતથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહોર કર્યો અને ખુહારી, ખારડોલી, નવસારી, ખીલીમોરા, ગણુદેવી, અમલસાડ, પાલધર તથા અંધેરી થઈ મુંબઈ પધાર્યા. મુંબઈમાં લાલબાગ તથા ગોડીજીના ઉપાશ્રયના દ્રસ્ટીઓએ ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી જેથી પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે લાલબાગના ઉપાશ્રયે ચતુર્માસ રહ્યા, અને પોતાના વિદ્વાન્ શિષ્ય-રત્ન

મુનિરાજ શ્રી કંચનવિજયજીને ગોડીજીના ઉપાશ્રયે ચતુર્માસ માટે જવા આજ્ઞા કરતાં તેઓશ્રીનું સંવત ૧૯૮૯ની સાલનું ચતુર્માસ મુંબઈ-ગોડીજીના ઉપાશ્રયે થયું. આ સાલમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ-સ્વામીની નક્કર સોનાની આંગી તથા હીરા-માણિકનો મુગટ તૈયાર થયો હતો, તે નિમિત્તે અઠ્યાઈ-મહોત્સવ તથા શાંતિસ્નાત્ર લાણાવવામાં આવ્યું અને ઉદ્ધાસ-પૂર્વક ગોડીજી લગવાનને એ દિવ્ય આંગી-મુગટ ચડાવવામાં આવ્યાં. મુનિરાજ શ્રી કંચનવિજયજીના સદ્ગુપદેશથી પરમ પ્રતિભાસંપન્ન, શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબની લવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગોડીજીના દેરાસરના દ્રસ્ટીઓ તથા આગેવાનોએ પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજના શુભ હસ્તે કરાવી. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે સદ્ગુપદેશ આપી ગોડીજીના ઉપાશ્રયે ચૌદ પૂર્વ તથા અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરાવી, જેનો લાભ ઘણા ભાવિક શ્રાવકો તથા શ્રાવિકાઓએ લીધો. વળી લાલ ખાગમાં પણ ગુરુદેવ પંન્યાસજી શ્રી લક્ષ્મિવિજયજી મહારાજે અનેક ભાઈ-બહેનોને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન તપસ્યા કરાવી. એ તપસ્યા નિમિત્તે પર્યુષણ અગાઉ બંને સ્થળેથી એકજ તિથિએ ઘણાજ ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. મુંબઈના સુપ્રસિદ્ધ બેંડો અને વાજિંત્રોથી ગાજી ઉઠેલા બંને વરઘોડા ઝવેરી ખભરમાં મમ્માદેવીના મંદિર પાસે ભેગા થયા, અને ત્યાંથી બંને વરઘોડા સાથે ચાલ્યા. સંખ્યાબંધ મુનિરાજે, ગોડીજી અને લાલખાગના દ્રસ્ટીઓ, આગેવાનો અને હબરો ભાઈ-બહેનોનો સામુદાયિક સહકાર તથા ઉદ્ધાસ જોઈ અન્ય ધર્મીઓમાં પણ સારી છાપ પડી, અને જૈનશાસનની શોભામાં અભિવૃદ્ધિ થઈ.

મુનિરાજ શ્રી કંચનવિજયજી ચતુર્માસ પૂર્ણ થતાં મુંબઈથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી અંધેરી આવ્યા. અંધેરીથી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી આણંદવિજયજી, જગતવિજયજી અને ચરણવિજયજી સાથે સુરત તરફ વિહાર કર્યો. સુરત પહોંચવાને બે મુકામ બાકી હતા તેવામાં સુરત-હરિપુરાના સંઘને ખબર પડતાં ત્યાંના સંઘના અગ્રેસરો સામા આવ્યા, અને હરિપુરાના ઉપાશ્રયે પધારવા આગ્રહભરી વિનંતિ કરી, મુનિરાજ શ્રી કંચનવિજયજી સુરત પધારતાં હરિપુરાના સંઘે ધામધૂમથી સામૈયું કર્યું અને તેઓશ્રી હરિપુરાના ઉપાશ્રયે પધાર્યા. આ વખતે કચ્છ-ખિદડાના રહીશ પરમ વૈરાગી શા. રવજીભાઈ શીવજી દીક્ષા અંગીકાર કરવા માટે મુંબઈથી સુરત આવ્યા. તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહા શુદ્ધિ પ ના રોજ લાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી રંજનવિજયજી રાખ્યું; અને તેમને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજીમહારાજના શિષ્ય કર્યા. આ અરસામાં અમદાવાદમાં મુનિ સમ્મેલન ભરાવાનું હોવાથી તેમાં લાગ લેવા માટે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિ શ્રી આણંદવિજયજી વિગેરે ઠાણાઓ સાથે સુરતથી વિહાર કર્યો, અને અમદાવાદ પધાર્યા. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પણ પોતાના બહોળા શિષ્ય-પરિવાર સાથે અંધેરીથી વિચરતા વિચરતા સુરત થઈ મુનિ-સમ્મેલનમાં હાજરી આપવા અમદાવાદ પધાર્યા.

મુનિ સમ્મેલનમાં સક્રિય લાગ લઈ મુનિરાજ શ્રી કંચન-વિજયજી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે અમદાવાદથી વિહાર

કરી વીરમગામ આવ્યા, અને ત્યાં મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે સાથે ગુરુદેવની આજ્ઞાથી અભ્યાસ માટે રોકાયા. વીરમગામમાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભોયણી તીર્થની યાત્રા કરી પાનસર આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન-વંદન કરી આહલાદ પામ્યા. પાનસરથી ગુરુદેવની આજ્ઞાથી પોતાના શિષ્યરત્ન મુનિ શ્રી જગતવિજયજી સાથે વિહાર કર્યો, અને વીરમગામ થઈ વિચરતા વિચરતા ભાવનગર આવ્યા. ત્યાં થોડા દિવસ રોકાઈ ગુરુમહારાજની આજ્ઞાથી વિહાર કરી ખંભાત પધાર્યા અને ત્યાં ગુરુદેવના દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સંવત્ ૧૯૯૦ નું ચતુર્માસ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યો સાથે ખંભાતમાં કર્યું. અહીં ગુરુદેવની નિશ્રામાં ભાદરવા શુદ્ધિ ૧૩ ના રોજ ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ કર્યો.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં
ગુરુદેવના શુભ હસ્તે અપાયેલ ગણિપદ
તથા પંન્યાસપદ.

ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે ખંભાતથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પોતાના વિદ્વાન્ અને ચારિત્રપાત્ર શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજી તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજી જેઓ શ્રી ભગવતી સૂત્રનાયોગમાં હતા, તેમને ગણિપદ તથા પંન્યાસપદ આપવાનો સમય નજીક આવવાથીએ હકીકત પાલીતાણાના શ્રીસંઘને

જણાવતાં પરમ હર્ષ ફેલાયો. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર ભાવસાર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી, વરતેજવાળા ભાવસાર ગાંડાલાલ માનચંદ, તથા ધંધુકાવાળા ' ભાવસાર વેલાણી-ભાઈઓ વિગેરે તરફથી મોતી કડીયાની ધર્મશાલામાં ધામધૂમથી અઢાઈ મહોત્સવ થયો. આ મહોત્સવમાં મોટી ટોળીવાળાઓએ વિવિધ રાગ-રાગણીથી હંમેશાં પૂજાઓ ભજાવી. સ્થાનિક સંઘ ઉપરાંત બહારગામથી પણ સારી સંખ્યામાં માણસો આવ્યા હતા, જેમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી પોતાના ધર્મપત્ની બાઈ શાંતા તથા પુત્ર ધીરજલાલ સાથે આવ્યા હતા. વળી તેઓશ્રીના સંસારી મામા પીતાંબરદાસ ભવાનદાસ નાવડીયા તથા ભાયચંદ જેરામ નાવડીયા વિગેરે ભાવસાર ભાઈઓ આ શુભ પ્રસંગે પોતાના કુટુંબ સાથે ઠીક ઠીક પ્રમાણમાં આવ્યા હતા. મોતી સુખીયાની ધર્મ-શાલામાં નાણુ મંડાવી, અને પંન્યાસજી શ્રી ભક્તિ-વિજયજી મહારાજે સંવત ૧૯૯૧ ના મહા શુદ્ધિ ૬ ના રોજ ચડતે પહોરે પોતાના સંયમશીલ શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજીને ગણિપદ તથા પંન્યાસપદથી વિભૂષિત કર્યા; તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. આ નાણુમાં ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ જુદા જુદા વ્રત ઉચ્ચર્યા, અને શાસનની પ્રભાવના સારી રીતે થઈ.

ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય પોતાના ગુરુદેવ વિગેરે મુનિરાજે સાથે પાલીતાણાથી વિહાર કરી, તાલધ્વજ તીર્થની યાત્રા કરી ટાણા, દેવગાણા વિગેરે

ગામોમાં વિચરતા વિચરતા ભાવનગર પધાર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી શિહોર, દેવગાણા વિગેરે શહેરો તથા ગામોમાં વિચરી પાછા ભાવનગર આવ્યા. અહીં ચતુર્માસ માટે કોળીયાકના સંઘની વિનંતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી પોતાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજી તથા જગતવિજયજી સાથે ભાવનગરથી કોળીયાક પધાર્યા, અને સંવત ૧૯૯૧ નું ચતુર્માસ કોળીયાકમાં કર્યું.

ૐ મુનિરાજ શ્રી આણંદવિજયજીનો સ્વર્ગવાસ.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ કોળીયાકમાં આવ્યા બાદ તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજીની તળિયત અસાડ માસમાં એકાએક લથડી. કોળીયાકના વિનયી અને ભક્તિભાવવાળા શ્રી સંઘ તરફથી ઘણા ઉપચાર કરવા છતાં તળિયત દિવસે દિવસે વધારે બગડતી ગઈ. તેઓશ્રીએ દેવસી પ્રતિક્રમણ કર્યું. અને રાત્રે નવ બજે સંધારા પોરિસી ભણાવતાં તેની ચૌદમી ગાથાનું પ્રથમ ચરણ અરિહંતો મહા દેવો એ પવિત્ર વાક્યનું ઉચ્ચારણ કરતા એ મહામના મુનિવર્ય અસાડ માસમાં પૂર્ણ સમભાવપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. અહા ! કેવું સમાધિ મરણ ? કોળીયાકના શ્રી સંઘ તરફથી પાલખી શણગારવામાં આવી. સવારમાં ધામધૂમથી. શ્મશાન યાત્રા નીકળી, જેમાં સંખ્યાબંધ જૈનો તથા જૈનેતરો જોડાયા; અને શોકમગ્ન હૃદયે એ મહાત્માના ક્ષણભંગુર દેહને અગ્નિદાહ દેવામાં આવ્યો.

એ શુભ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ થયો. રાધનપુરવાળા હર-ગોવિંદદાસ સરૈયા તરફથી દેરાસરજીની 'બહાર એક દેરી કરાવવામાં આવી, તેમાં કોળીયાકવાળા ઉકાલાઈ હરખચંદ તરફથી મુનિરાજ શ્રી આણંદવિજયજી મહારાજની પાદુકા વિધિપૂર્વક પધરાવવામાં આવી. આ દેરીમાં કોઈ કોઈવાર સુગંધી ધુપના ગોટેગોટા નીકળતા ઘણા માણસોએ નજરે દીઠા છે.

કોળીયાકમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી કેટલાક શ્રાવક-શ્રાવિકાઓએ પીસ્તાળીશ આગમ, ચૌદ પૂર્વ અને અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરી. પર્યુષણમાં અઠ્ઠાઈ મહોત્સવ ધામ-ધૂમથી ઉજવાયો, ઘણા ભાઈ-બહેનોએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, અને પર્યુષણ બાદ ભિન્ન ભિન્ન ગૃહસ્થો તરફથી આઠ નવકારશી થઈ. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી કોળીયાકના શ્રી સંઘ તરફથી આસો શુદ્ધિ ૧૦ ના રોજ ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક ઉપરાંત બહાર ગામથી પણ કેટલાક માણસો આવીને બેઠા હતા. પંન્યાસજી મહારાજે માગશર શુદ્ધિ બીજના રોજ તપસ્વીઓને માળા પહેરાવી.

રાણપુર નિવાસી શેઠ કુંગરસી કસ્તુરચંદ સ્વીકારેલી દીક્ષા, તેમનું રાખેલું મુનિ શ્રી મહોદયવિજયજી નામ.

ઉપધાનની માળાનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજીના સદુપદેશથી કોળીયાકના ભાવસાર ઓઘડ કાનજી

શુદ્ધીગરા વિગેરે તરફથી પાલીતાણાનો છરી પાળતો સંઘ કાઢવામાં આવ્યો.' કોળીયાકમાં ઉપધાન થયા ત્યારે રાણપુર નિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસના ભત્રીજા શેઠ ડુંગરશી કસ્તુરચંદ કોળીયાક આવ્યા હતા, અને તેમણે પણ ઉપધાન કર્યા. એ વખતે વૈરાગ્યવાસીત ડુંગરશીભાઈને દીક્ષા લેવાની ભાવના થઈ હતી, અને એ હકીકત તેમણે પંન્યાસજી મહારાજને જણાવેલી. તેઓ કોળીયાકથી પાલીતાણાના છરી પાળતા સંઘ સાથે આવ્યા. સંઘનો મુકામ થોરડી ગામમાં થયો ત્યારે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૯૨ના માગશર વદિ ૬ના રોજ શેઠ ડુંગરશી કસ્તુરચંદને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી મહોદયવિજયજી રાખ્યું, અને તેમને પોતાના શિષ્ય કર્યા.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના શિષ્યો તથા સંઘ સાથે થોરડીથી વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર સંઘવીને તીર્થમાળ પહેરાવી, તથા શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી આત્મિક ઉદ્ધાસ અનુભવ્યો. પાલીતાણામાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી પોતાના શિષ્યો સાથે વિહાર કર્યો; અને ઘેટી, જેસર, દેપલા, છાપરીયાળી તથા દાઠા થઈ મહુવા ગયા; અહીં નાણુ મંડાવીને પોતાના શિષ્ય મુનિરાજ શ્રી મહોદયવિજયજીને કાગણુ માસમાં વડી દીક્ષા આપી. ત્યારબાદ મહુવાથી વિહાર કરી તલાબ આવ્યા, અને ત્યાં ચૈત્રી ઓળી કરી. ચૈત્રી-પુનમના દેવવંદન પ્રસંગે મોટો સમીયાણો ઉભો કરવામાં આવ્યો, તેમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે દેવવંદન કરાવ્યું. એ

પવિત્ર ક્રિયામાં જૈનોના મોટા સમુદાય ઉપરાંત જૈનેતરો તથા ન્યાયાધીશ, થાણુદાર, ફોજદાર વિગેરે અમલદારોએ પણ ભાગ લીધો હતો. વળતે દિવસે પરમાત્માના રથ સહિત ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો, તેમાં પણ જૈનો તથા જૈનેતરો ઉપરાંત તમામ અધિકારી વર્ગ સામેલ થયો હતો.

પરમોપકારી ગુરુદેવને અપાયેલી આચાર્ય પદવી.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી તલાબમાં હતા, એ વખતે ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ સાહેબને પાલીતાણામાં આચાર્ય પદવી આપવાનું નક્કી થવાથી એ શુભ પ્રસંગે પધારવા શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી પત્ર આવ્યો; જેથી તેઓશ્રી પોતાના શિષ્યો સાથે તળાબથી વિહાર કરી પાલીતાણા પધાર્યા. આચાર્ય પદવીના માંગલિક પ્રસંગે શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી મોતી સુખીયાની ધર્મ-શાળામાં ઘણાજ ઠાઠમાઠથી જુદા જુદા તીર્થોની રચના સાથે અઠાઈ મહોત્સવ શરૂ થયો. સંવત ૧૯૯૨ ના વૈશાખ શુદ્ધ ૪ શનિવારના રોજ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે મોતી સુખીયાની ધર્મશાળામાં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી એ નામથી પ્રસિદ્ધ થયા.

ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત

૧૯૯૨ની સાલનું ચતુર્માસ પાલીતાણામાં મોતી સુખી-
યાની ધર્મશાળામાં કર્યું. ચોમાસા અગાઉ શંખલપુર, હાલ
ભાવનગરના રહીશ ભાવસાર નાનાલાલ ભવાનદાસ પોતાના
ખંધુ ભૂદરદાસ સાથે પાલીતાણા આવ્યા હતા. પરમ વૈરાગી
ભાઈ નાનાલાલને દીક્ષા લેવાની ઇચ્છા થતાં તેમણે પંન્યાસજી
શ્રી કંચનવિજયજી મહારાજને એ હકીકત જણાવી, અને
તેમના ભાઈ ભૂદરદાસને પૂછતાં તેમણે સંમતિ આપી; જેથી
પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે અશાક શુદ્ધિ ૧૪
ના રોજ ભાવસાર નાનાલાલ ભવાનદાસને ભાગવતી
દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભદ્રંકરવિજયજી
રાખ્યું અને તેમને મુનિરાજશ્રી જગતવિજયજીના શિષ્ય
કર્યા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની
દેશના સાંભળી ઘણા શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા ખડેનોએ
એકાસણાથી ચોસઠ પહોરના પોસહ કર્યા, એ તપસ્વીઓની
ભક્તિ જુદા જુદા ગૃહસ્થો તરફથી થઈ. વળી તેઓશ્રીના
સદ્ગુણદેશથી ચૌદ પૂર્વ, અષ્ટ મહાસિદ્ધિ, અક્ષય નિધિ અને
પીસ્તાળીશ આગમની તપસ્યા ઘણા ભાઈ-ખડેનોએ વિધિપૂર્વક
કરી; તે નિમિત્તે વરઘોડા ચડાવવામાં આવ્યા, તથા અઠ્ઠાઈ-
મહોત્સવ થયો. આ ચતુર્માસ દરમિયાન ખાટકીઓ ૧૮૦૦
ઘેટાંઓને કસાઈવાડે ભઈ જતા હતા, તેની પંન્યાસજી મહારાજને
ખબર પડતાં વ્યાખ્યાનમાં અભયદાન ઉપર સચોટ
ઉપદેશ આપ્યો. તુરતજ શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા ખડેનોએ
છૂટે હાથે ફંડ એકડું કર્યું, જેથી એ નિર્દોષ ૧૮૦૦ ઘેટાં-
ઓને છોડાવવામાં આવ્યા.

પંન્યાસજી મહારાજના સદ્ગુણદેશથી લાલોસણવાળા મણિ

ખડેન, વીરમગામવાળા સમરત ખડેન, તથા પાટણવાળા શેઠ મોહનલાલ ઉત્તમચંદ તરફથી મોતી સુખીયાની ધર્મશાળામાં આસો શુદ્ધિ ૧૦ના રોજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, તેમાં સ્થાનિક ઉપરાંત બહાર ગામથી પણ આવીને સંખ્યા-બંધ લાઈ-ખડેનોએ પ્રવેશ કર્યો. ઉપધાનની ક્રિયા ચાલતી હતી એ અરસામાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સુરતથી આવેલા નેમા વાણીયા લાઈશ્રી ચુનીલાલને સંવત ૧૯૯૩ના કારતક વદિ ૨ના રોજ પત્તાલાલની ધર્મશાળામાં ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કૈલાસવિજયજી રાખ્યું, અને તેમને પોતાના શિષ્ય કર્યા. માગશર શુદ્ધિ ૨ના રોજ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓને ધામધૂમથી ઉપધાનની માળા પહેરાવવામાં આવી, વળી એ જ સમયે તેઓશ્રીએ મુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી તથા મુનિરાજશ્રી કૈલાસવિજયજીને વડી દીક્ષા આપી.

ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના શિષ્ય-સમુદાય સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી વિચરતા વિચરતા અમદાવાદ પધાર્યા, અને શાહપુર-મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે ઉતર્યા. અહીંના સંઘના અગ્રેસર શેઠ ડાહ્યાલાઈ સાંકલચંદ વિગેરેની આગ્રહભરી વિનંતિથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૯૩નું ચતુર્માસ અમદાવાદ-શાહપુર, મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે કર્યું. ચોમાસા દરમિયાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, અઠ્ઠાઈ-મહોત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક

ઠીક પ્રમાણમાં થયાં. પર્યુષણમાં તેઓશ્રીના શિષ્ય-રત્ન મુનિ-રાજશ્રી મહોદયવિજયજીએ ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી.

ચતુર્માસ બાદ લીંચના સંઘના અંગ્રેસરો લીંચમાં ઉપધા-નની માળ પહેરાવવા માટે પધારવાની વિનંતિ કરવા અમદાવાદ આવ્યા. તેમની વિનંતિ સ્વીકારી પંન્યાસજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી પાનસર અને સેરીસા તીર્થની યાત્રા કરી લીંચ પધાર્યા, અને ત્યાં તેઓ-શ્રીએ પોતાને શુભ હસ્તે ઉપધાન કરનાર તપસ્વીઓને ધામ-ધૂમથી માળ પહેરાવી. લીંચમાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ ત્યાંથી વિહાર કર્યો, અને વડાવલી થઈ ગામ ચવેલી પધાર્યા. ચવેલીના શ્રીસંઘે પરમાત્માના પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે કરાવવાનો નિર્ણય કર્યો હતો, જેથી શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી આચાર્યજી મહારાજ પોતાના બહોળા શિષ્ય-પરિ-વાર માથે વિચરતા વિચરતા ગામ ચવેલી પધાર્યા. અહીં ગુરુદેવનાં દર્શન-વંદન કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પરમ આહલાદ પામ્યા. પ્રતિષ્ઠાના માંગલિક પ્રસંગે ચવેલીમાં ઠાઠમાઠથી અઠાઇ-મહોત્સવ શરૂ થયો, અને વૈશાખ વદિ ૬ ના દિવસે સવારે શુભ મુહૂર્તે આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દેવાધિ-દેવ શ્રી વિમલનાથ સ્વામીના લવ્ય પ્રતિમાજીને તખ્ત-નશીન કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે ચવેલીથી વિહાર કર્યો. અને લણવા, કંથરાવી, ધીણુજ, ચાણુસ્મા થઈ રૂપર તીર્થની યાત્રા કરી પાટણ પધાર્યા. તેઓશ્રીએ સંવત્

૧૯૯૪ નું ચતુર્માસ ગુરુદેવ સાથે પાટણમાં કર્યું. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સંયમશીલ વિનયી અને વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજ શ્રી જગતવિજયજી અસાડ વદિ ૧૧ ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. તેમના શુભ નિમિત્તે શ્રાવણ શુદ્ધિ ૨ થી અઠ્ઠાઈ-મહોત્સવ સુંદર રીતે ઉજવાયો. વળી તેમના શુભ નિમિત્તે ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ પ્રકારની તપસ્યા, યાત્રા, પોસહ, સામાયિક વિગેરે કર્યા, ચોમાસામાં આચાર્યજી મહારાજ હંમેશાં વ્યાખ્યાન વાંચતા હતા, પરંતુ તેઓશ્રીની તબિયત નરમ થઈ જવાથી બે મહિના પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ધે વ્યાખ્યાન વાંચ્યું હતું. તેઓશ્રીએ પર્યુષણમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. આચાર્યજી મહારાજના સદ્ગુણદેશથી પાટણમાં ઉપધાન કરાવવામાં આવ્યા, તેની ક્રિયા પંન્યાસજી મહારાજે કરાવી હતી.

તપસ્વીઓને ઉપધાનની માહારોપણ વિધિ પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિએ ગુરુદેવની આજ્ઞાથી શિષ્ય-પરિવાર સાથે પાટણથી વિહાર કર્યો, અને વઢવાણ થઈ લીંબડી આવ્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાવનગર પધારતાં ઠાઠમાઠથી જામૈયું થયું. પંન્યાસજી મહારાજ ભાવનગર પધારતાં તેઓશ્રી પાંચે ભાવનગર નિવાસી ભાવસાર ભાયચંદ જેરામભાઈ નાવડીયાને દીક્ષા અંગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગૃત થઈ. તેમણે પોતાના ધર્મપત્ની બાઈ જીવી તથા પુત્ર ભાઈ રતિલાલ વિગેરેની સમ્મતિ મેળવી, અને એ હકીકત તેમણે પંન્યાસજી મહારાજને જણાવતાં તેઓશ્રીએ પણ અનુમતિ આપી. દીક્ષાના માંગલિક પ્રસંગે વૃંદામાં આવેલા તેમના ઘેરથી ઠાઠમાઠથી વરઘોડો ચડ્યો, અને દાદા

સાહેબમાં ઉતર્યો. પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિ-
વર્યે સંવત ૧૯૯૫ ના મહા વદિ ૮ ના રોજ દાદા
સાહેબની વાડીમાં ચતુર્વિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે ભાઈ
શ્રી ભાયચંદ જેરામ નાવડીયાને ભાગવતી દીક્ષા આપી,
તેમનું નામ મુનિ શ્રી ભરતવિજયજી રાખ્યું, અને તેમને
પોતાના શિષ્ય કર્યો. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી ભરત-
વિજયજીનાં સંસારી પુત્ર ભાવસાર રતિલાલ ભાયચંદ નાવડીયા
તરફથી વડવાના દેરાસરે આંગી રચાવવામાં આવી, ઠાઠમાઠથી
પૂજા ભણાવવામાં આવી, તથા વડવામાં સાધર્મિક વાત્સલ્ય
કર્યું. પંન્યાસજી મહારાજે ભાવનગરમાં ફાગણ માસમાં મુનિ-
રાજ શ્રી ભરતવિજયજીને વડી દીક્ષા આપી. વળી
તેઓશ્રીએ ભાવનગરમાં ચૈત્રી ઓળી કરી, તથા ચૈત્રી પૂનમના
દેવ વંદાવ્યા.

ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગાણીશ્વરે પોતાના
શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને વિચરતા
વિચરતા પાલીતાણા પધાર્યો. તેઓશ્રીએ સંવત ૧૯૯૫ નું
ચતુર્માસ પાલીતાણામાં મોતી-સુખીયાની ધર્મશાળામાં
કર્યું. પંન્યાસજી મહારાજની વૈરાગ્ય ઝરતી દેશના સાંભળી
ઘણા શ્રાવક-શ્રાસિકાઓએ માસખમણ, ૧૬ ઉપવાસ વિગેરે
વિવિધ તપસ્યા કરી. તે નિમિત્તે ઠાઠમાઠથી અઠાઈ મહોત્સવ
થયો, તથા અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી
આસો શુદ્ધિ ૧૦ ના રોજ અમરેલીવાળા શેઠ બાબુલાલ ઉત્ત-
મચંદ તરફથી ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં બેઠેલા

તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ હતી. માળ પ્રસંગે શેઠ બાબુલાલ તરફથી ઠાઠમાઠથી અઠાઇ-મહોત્સવ થયો, તથા તેમના તરફથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. માગશર શુદ્ધિ બીજના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. માળની બોલી વખતે શેઠ બાબુલાલે ચડાવો કરી પોતાની સુપુત્રી જહેન શારદાને પહેલી માળ પહેરાવવાનો લાલ લીધો હતો. આવી રીતે માળની શુભક્રિયા પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજના સદ્-પદેશથી થરાવાળાએ બાર ગાઉનો સંઘ કાઢ્યો, જેમાં ચતુર્વિધ સંઘ સાથે પંન્યાસજી મહારાજ પણ પોતાના શિષ્ય-પરિવાર સહિત પધાર્યા હતા. બાર ગાઉની પ્રદક્ષિણા કરી તેઓશ્રી પાછા પાલીતાણા આવ્યા.

ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને લીંબડી તથા વઢવાણ થઈ લખતર પધાર્યા. પંન્યાસજી મહારાજે લખતરના દરબાર શ્રી વિક્રમસિંહજીને સચોટ સદ્વપદેશ આપી શિકાર બંધ કરાવ્યો. વળી એજ વખતે દરબારશ્રીએ યાવજીવ દાડ-માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ પંન્યાસજી મહારાજ લીલાપુર ગયા. અહીં કચ્છ-વાગડ ગામ લાકડીયાના રહીશ પરમ વૈરાગી જહેન સંતોકને દીક્ષા લેવાનું નક્કી થતાં તે નિમિત્તે લીલાપુરના ઠાકોરે પોતાને ખર્ચે ઠાઠમાઠથી વરઘોડો ચડાવ્યો. પંન્યાસજી મહારાજે ફાગણ વદિ ૧ ના રોજ જહેન સંતોકને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાધ્વીજીશ્રી સુમંગલાશ્રીજી રાખ્યું અને તેમને સાધ્વીજીશ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે લીલાપુરથી વિહાર કરી વીરમગામ થઈ ભોયણીજી તીર્થની યાત્રા કરી તારંગાજી તીર્થ પધાર્યા. ત્યાં ચૈત્રી ઓળી કરી, તથા ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. તારંગાજીથી વિહાર કરી ગઢજીલામાં આવેલા ગામ ભાલોસણા થઈ આખુ પધાર્યા. ત્યાં આઠેક દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી વેલાંગડી થઈ ગામ પાડીવ ગયા. ત્યાં આઠેક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિચરતા વિચરતા જવાલ પધાર્યા અને જવાલના શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૯૬ નું ચતુર્માસ જવાલમાં કર્યું.

કેટલાક વખતથી જવાલના સંઘમાં કુસંપ ચાલતો હતો. ધીરે ધીરે એ કારમા કુસંપનું જોર એટલુંબધું વધી ગયું કે ત્યાંના સંઘમાં પાંચ તડ પડી ગયા ! આને લીધે વ્યવહારિક કાર્યો ઉપરાંત ધાર્મિક કાર્યો પણ અટકી ગયા; જેથી દેરાસરજી ઉપર કેટલાક વરસથી ધ્વજદંડ ચડાવાયો નહોતો, પ્રભાવના સુદ્ધાં બંધ હતી. શ્રીસંઘમાં આવું કલેશમય વાતાવરણ જોઈ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને ખેદ થયો. તેઓશ્રીએ સંઘમાં સંપ કરાવવા અવિચ્છિન્નપણે એક મહિનો પ્રયાસ કર્યો અને સચોટ સદુપદેશ આપી પાંચે તડને ભેગા કર્યા, જેથી સંઘમાં કલેશને ઠેકાણે શાંતિમય વાતાવરણ જન્મ્યું. હર્ષાન્વિત અને ઉત્સાહિત થયેલા જવાલના શ્રી સંઘને પંન્યાસજી મહારાજે ધ્વજદંડ ચડાવવા માટે સદુપદેશ આપતાં એ માટે એક ગુપ્ત ભંડાર રાખવામાં આવ્યો. તેમાં ધ્વજદંડ ચડાવવામાં વિધિ-વિધાન વિગેરે માટે રૂપિયા ૧૧૫૦) એકઠા થયા.

ધ્વજદંડ ચડાવતાં થયેલા દિવ્ય કેસરનાં છાંટણાં.

જવાલના દેરાસરજી ઉપર અશાડ શુદ્ધિ ૬ ના રોજ શુભ ચોઘડીએ ધામધૂમથી વિધિપૂર્વક ધ્વજદંડ ચડાવવામાં આવ્યો, તે શુભ નિમિત્તે શાંતિસ્નાત્ર લણાવ્યું, તથા નવકારશી થઈ, જેમાં પાંચે તડ લેગા બેસીને જમ્યા. એ દિવસે દેરાસરજી ઉપર તથા ગામમાં દિવ્ય કેસરનાં છાંટણાં થયાં; જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું, અને જૈન શાસનની પ્રભાવના થઈ. ધ્વજદંડના ચડાવા વિગેરેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણી સારી થઈ. ધ્વજદંડના શુભ પ્રસંગે આવેલા લોજકો તથા પ્રાહ્મણો વિગેરેને રૂપીયા ૫૦૦) દક્ષિણામાં આપ્યા. આ વખતે જવાલમાં સાધ્વીજીશ્રી મેઘશ્રીજી, ઇન્દ્રશ્રીજી, સુમંગલાશ્રીજી વિગેરે સાધ્વીજી મહારાજેના ચાર ઠાણા ચોમાસું રહ્યા હતા. પંન્યાસજી મહારાજે અશાડ શુદ્ધિ ૬ ના રોજ સાધ્વીજીશ્રી સુમંગલાશ્રીજીને વડી દીક્ષા આપી તેમને સાધ્વીજી શ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં હંમેશાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેનો લાભ જૈનો ઉપરાંત જૈનેતરો પણ સારી સંખ્યામાં લેતા હતા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહોદયવિજયજી, મુનિરાજ શ્રી મનોહરવિજયજી, તથા સાધ્વીજી શ્રી મેઘશ્રીજીએ માસખમણનાં પચ્ચખખાણુ લીધાં. આવી ઉત્ર તપસ્યાની અનુમોદના કરતા શ્રદ્ધાળુ ભિન્ન ભિન્ન શ્રાવક-શ્રાવિકાઓ તરફથી છપ્પન પૂજા નોંધાવવામાં આવી. હંમેશાં

મધુર સંગીત સાથે જુદી જુદી પૂજાઓ લાણાવાઈ. પ્રભાવના કરવામાં આવી, ચિત્તને આહલાદ પમાડે તેવી અંગરચના થઈ, તથા હમેશાં રાત્રે ભાવના ભાવવામાં આવતી હતી. તપસ્યા નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠાઈ-મહોત્સવ થયો, તથા એક સંગીત-મંડલીની સ્થાપના કરવામાં આવી. પર્યુષણ પૂર્ણ થતાં નવ-કારશી થઈ. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના પંચે એવો ઠરાવ કર્યો કે, કોઈએ એકું મૂકવું નહિ, એકું મૂકનારે સવાપાંચ આના દંડના ભરી દેવા. વળી એક થાળીમાં ભેગા ખેસીને જમવું નહિ.

પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના શેઠ શંકર હરજી પોરવાડ તરફથી કારતક વદિ પાંચમના રોજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, જેમાં શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ મળી ૩૫૦) માણસોએ પ્રવેશ કર્યો. માળ પ્રસંગે શેઠ શંકર હરજી તરફથી પાંચ છોડનું ઉજમણું કરવામાં આવ્યું. પોષ શુદ્ધિમાં શેઠ હકમાજી તેજજીના નોરામાં નાણુ મંડાવવામાં આવી. અને હજારો માણસોની મેદની વચ્ચે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે ધામધૂમથી તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. એજ દિવસે ઉદાર દિલના શેઠ શંકર હરજીએ નવકારશી કરી, તથા આખા ગામમાં ધૂમાડો બંધ કરાવી અઠારે નાતને મિષ્ટાન્ન લોજન કરાવ્યું. વળી તેમણે ૩૫૦ તપસ્વીઓને રૂપાના વાટકાની પ્રભાવના કરી મળેલી શુભ લક્ષ્મીને સદ્વ્યય કર્યો. તે સિવાય ભિન્ન ભિન્ન ગૃહસ્થોએ પણ તપસ્વીઓને કિંમતી વસ્તુઓની પ્રભાવના કરી હતી. ઉપધાન તથા ઉજમણા પ્રસંગે શેઠ શંકર હરજીએ પચ્ચીશહજાર રૂપિયાનો સદ્વ્યય કર્યો હતો. જાવાલના

શ્રીસંઘે પાંચે દેરાસરજીમાં ગુપ્ત ભંડાર કરાવ્યા. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી શા. પત્તાલાલ પ્રાગજીભાઈએ રૂપાનો રથ કરાવ્યો. ઉપધાનની માળ વખતે છપ્પન હજાર રૂપિયાની આવક થઈ હતી, એ દ્રવ્યથી શ્રી સુમતિનાથ ભગવાનના દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તથા ઇન્દ્રધ્વજ કરાવવામાં આવી. જવાલના કેટલાક શ્રાવકભાઈઓ પાસે ઘણા વખતથી ધર્મોદ્ધાની રકમ લેણી ખેંચાતી હતી, એ પતતી નહોતી. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ચોપડા ચોખ્ખા કરાવ્યા.

આવી રીતે અનેક શુભ કાર્યો કરી પંન્યાસજી શ્રી કંચન-વિજયજી ગણિવર્ચે પોતાના શિષ્ય-પરિવાર સાથે જવાલથી વિહાર કર્યો, અને લાસ ગામના સંઘની વિનતિથી લાસ ગયા. અહીંના પંચમાં પણ કેટલાક વખતથી કુસંપ હતો, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યો, જેથી સંઘમાં આનંદ ફેલાયો, અને એ નિમિત્તે અઠાઈ મહોત્સવ કર્યો તથા શાંતિસ્નાત્ર ભણાવ્યું. ત્યાંથી વિહાર કરી પાછા જવાલ થઈ સીરોહી ગયા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રાવિકા જહેન ભાગીરથીએ સીરોહીથી બ્રાહ્મણવાડાનો છરી પાળતો સંઘ કાઢ્યો, સંઘ સાથે પંન્યાસજી મહારાજ પણ પધાર્યા. બ્રાહ્મણવાડામાં જહેન ભાગીરથી તરફથી નવકારશી થઈ. ત્યાંથી સંઘ સાથે પંન્યાસજી મહારાજ પાછા સીરોહી આવ્યા. ત્યાં નાણુ મંડાવવામાં આવી, અને પંન્યાસજી મહારાજ પાસે ઘણા ભાઈઓ તથા જહેનોએ ચતુર્થ વ્રત, બારવ્રત, વિગેરે વિવિધ વ્રતો ઉચ્ચરી આત્માને પાવન કર્યો. સીરોહીથી વિહાર

કરી પ્રાચીન તીર્થ કારોલ ગયા. અહીં પાંચ દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કારોલ તીર્થની યાત્રા કરી કોરટા તીર્થ ગયા, અને શ્રી આદીશ્વર પરમાત્માના ભવ્ય પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી આત્મિક ઉદ્ધાસ પામ્યા. અહીં સાત દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કોરટા તીર્થની યાત્રા કરી ત્યાંથી વાંકડી થઈ શિવગંજ પધાર્યા, અને પોરવાડના ઉપાશ્રયમાં ફાગણ ચોમાસી ચૌદશ કરી. શિવગંજના સંઘે ચોમાસા માટે વિનંતિ કરી, પરંતુ ચતુર્માસને હજી વાર હોવાથી વિનંતિ ન સ્વીકારી.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શા. કૃત્તેચંદ ગોમાજી પોરવાડે શિવગંજથી જાકોડા તીર્થને છરી પાળતો સંઘ કાઢ્યો. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્ય-પરિવાર સાથે વિહાર કર્યો. જાકોડામાં શા. કૃત્તેચંદ ગોમાજી તરફથી નવકારશી કરવામાં આવી. ત્યાંથી પંન્યાસજી મહારાજ વાલી અને સાદડી થઈ રાણકપુર તીર્થની યાત્રા કરી, ભાણુવડ થઈ ઉદયપુર પધાર્યા. ત્યાં ચૈત્રી ઓળી અરધી કરી કેસરીયાજી ગયા. ત્યાં ચૈત્રી ઓળી પૂર્ણ કરી, તથા ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા.

ચૈત્ર શુદ્ધિ ૧૩ ના રોજ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની જન્મ-જયંતીનો વરઘોડો ઘણાજ દળદળા સાથે નીકળ્યો, વરઘોડામાં હજારો યાત્રાળુઓ તથા દૂર-દૂરથી ભીલ લોકો આવ્યા હતા. ચૈત્રી ઓળીનું પારણું કરી પંન્યાસજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કરી પાછા રાણકપુર આવ્યા, અને અક્ષય તૃતીયા રાણકપુર તીર્થમાં કરી.

ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી વાલી, મોંડાણા અને સુમેરપુર થઈ વડગામ આવ્યા.

શિવગંજના ભાવિક સંઘે પંન્યાસજી મહારાજને શિવગંજમાં ચોમાસું કરાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી સંઘના અગ્રેસરો ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા લેવા જુનાગઢ ગયા હતા. તેઓ આચાર્યજી મહારાજની આજ્ઞા લઈ વડગામ આવ્યા, અને શિવગંજમાં ચતુર્માસ માટે પધારવા આગ્રહભરી વિનતિ કરી. ગુરુદેવની આજ્ઞા થવાથી અને શ્રીસંઘની આગ્રહભરી વિનતિથી પંન્યાસજી મહારાજે તેમની વિનતિ સ્વીકારી; અને વડગામથી શિવગંજ પધાર્યા. સંઘ તરફથી ધામધૂમથી સામૈયું થયું, અને સંવત ૧૯૯૭નું ચતુર્માસ શિવગંજમાં ઓસવાદની ધર્મશાલામાં કર્યું.

આ અરસામાં ખરસલીયાના રહીશ શ્રીયુત હરજીવનદાસના ધર્મપત્ની પરમ વૈરાગી જહેન અજવાળી શિવગંજમાં દીક્ષા અંગીકાર કરવા આવ્યા હતા. જહેન અજવાળીને દીક્ષા આપવાનું નક્કી થતાં તેમની સાથે આવેલા તેમના ભાઈ શા. ગીરધર-લાલ મેઘજીભાઈ તરફથી ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. સં. ૧૯૯૭ના અસાડ શુદ્ધિ ૧૦ના રોજ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે પંન્યાસજી મહારાજે જહેન અજવાળીને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાધવીજી શ્રી રાજેન્દ્ર-શ્રીજી રાખ્યું, અને તેમને સાધવીજી શ્રી મેઘશ્રીજીના શિષ્યા કર્યા.

શિવગંજમાં પંન્યાસજી મહારાજની વ્યાખ્યાન-વાણી સાંભળવા હંમેશાં ઓશવાળ, પોરવાડ, તથા જૈનેતરો પણ નિયમિત

આવતા. અહીં ઓસવાળ લાઈઓના પંચમાં કેટલાક વખતથી કલેશ ચાલતો હતો, જેથી ઓસવાળના દેરાસરજી ઉપર ધ્વજ-દંડ ચડાવાતો નહોતો. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી તેઓમાં સંપ કરાવ્યો અને કલેશ દૂર કરાવ્યો. જેથી સોનાના ખોળાનો ધ્વજ-દંડ તથા ઈંડુ કરાવવામાં આવ્યું. વળી વ્યાખ્યાનના ઉપયોગ માટે શેઠ ફોજમલજી ઓસવાળે રૂપાના ખોળાના ત્રણ બાજે કરાવ્યા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહોદયવિજયજીએ માસખમણની ઉચ્ચ તપસ્યા કરી, તથા ખીજ પણ લાઈ-ખેડેનોએ યથાશક્તિ વિવિધ તપશ્ચર્યા કરી. કેટલાક લાઈઓ પાસે ધર્માદાની રકમ ખેંચાતી હતી, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ધર્માદા-સંસ્થાના ચોપડા ચોખ્ખા કરાવ્યા. સંવત્ ૧૯૯૮ ના માગશર શુદ્ધિ ૬ ના રોજ ઓસવાળના દેરાસરજી ઉપર ધામધૂમથી ધ્વજ-દંડ ચડાવવામાં આવ્યો, તે નિમિત્તે અઠ્ઠાઈ-મહોત્સવ થયો, વિધિપૂર્વક શાંતિસ્નાત્ર લણાવ્યું, તથા આખા ગામની નવકારશી થઈ, જેમાં જૈનો ઉપરાંત જૈનેતરે પણ જમ્યા. ધ્વજ-દંડ ચડાવ્યો તે વખતે જુદી જુદી ખોલીના મળી રૂપિયા પચ્ચીશ હજારની દેવદ્રવ્યની આવક થઈ.

શિવગંજથી પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે માગશર વદિમાં વિહાર કર્યો, અને જોઈલા આવ્યા. જોઈલાથી કોરટા તીર્થનો છરી પાળતો સંઘ નીકળ્યો, તે સાથે કોરટા આવ્યા. અહીં પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી ઘણા શ્રાવક-શ્રાવિકાઓને લસણ, ડુંગળી તથા વાસી ચોરાક ખાવાની ખાધા આપી. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ કોરટા પધાર્યા છે, એવી ખાતમી મળતાં જોગપરના સંઘના

અગ્રેસર શેઠ ફ્રેન્ચમલ્લ કોરટા આવ્યા, તેમણે પંન્યાસજી મહારાજને જોગાપરા પધારવા આગ્રહભરી વિનતિ કરી; જેથી પંન્યાસજી મહારાજ કોરટાથી વિહાર કરી જોગાપરા આવ્યા. તે દિવસે સાધર્મિક વાત્સલ્ય થયું. જોગાપરાના સંઘમાં બેહદ કુસંપ હતો, પંન્યાસજી મહારાજે ઘણો જ પ્રયાસ કરી, તથા સહુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યો. જોગાપરામાં ત્રણ દિવસ રોકાયા બાદ ત્યાંથી વિહાર કરી પાછા કોરટા આવ્યા. ત્યાંથી વિહાર કરી નોવી પધારતાં ત્યાંના શ્રી સંઘ તરફથી સામૈયું થયું. નોવીમાં શ્રાવકોની સો ઘરની ટુંકી વસ્તી હોવા છતાં એ નાનકડા સંઘમાં તડ પડી ગયા હતા, કુસંપ ઘણો હતો; જેથી દેરાસરજી તૈયાર હોવા છતાં પ્રતિષ્ઠા થઈ નહોતી. ઘણા વખતથી દેરાસરજીની સાર-સંભાળ ન લેવાયાથી ભીંતોમાં ચીરાડ પડી ગઈ, કેટલેક સ્થળે ઝાડ ઉગી ગયા, દરવાજાને વણખોલ્યા તાળા લગાવ્યા હતા. આવી દુઃખદ પરિસ્થિતિ જોઈ પંન્યાસજી મહારાજને ઘણો ખેદ થયો. તેઓશ્રીએ સંઘને એકઠો કર્યો, અને ઘણોજ પરિશ્રમ વેઠી તથા સહુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યો; જેથી સંઘમાં અનહદ આનંદ ફેલાયો. એ નવકારશી થઈ, જેમાં બધાય શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજના સહુપદેશથી શ્રી સંઘે સલાટો બોલાવી દેરાસરજીનું રીપેર કામ ચાલુ કરાવી દીધું. આ અરસામાં શીલધરના સંઘના અગ્રેસર શેઠ પુનાજી રામાજી વિગેરે નોવી આવ્યા. તેમણે કહ્યું કે, અમારે શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઢવાની ભાવના છે, માટે આપ શીલધર પધારો. આપ આવ્યા બાદ નક્કી થયે. આ પ્રમાણે શીલધર પધારવા તેમણે કરેલી વિનતિ પંન્યાસજી મહારાજે સ્વીકારતાં શીલધરથી આવેલા સંઘના અગ્રેસરો પાછા શીલધર ગયા.

પંન્યાસજી મહારાજ નોવીમાં દસેક દિવસ રોકાયા. તેઓશ્રીના સદુપદેશથી નોવીના પંચ તરફથી પાવઠાનો છરી પાળતો સંઘ નીકળ્યો; પંન્યાસજી મહારાજ પણ સંઘ સાથે નોવીથી વિહાર કરી પાવઠા પધાર્યા. પાવઠાથી તખતગઢ આવી ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી ઉમેદપુર તથા ગુડા-ખાલોતરા થઈ, આહોર આવી ત્યાં ચાર દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી વાગરા આવ્યા, ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી કાલંદ્રી તથા મોટાગામ થઈ પૂનગ આવ્યા. અહીંના સંઘમાં કેટલાક વખતથી ચાલ્યા આવતા કુસંપને પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યો, જેથી સંઘમાં આનંદ ફેલાયો. ઉદ્ધસિત થયેલા સંઘે અઠ્ઠાઈ-મહોત્સવ કર્યો, અને છેલ્લે દિવસે નવકારશી કરી, જેમાં ઘણા વખતથી અલગ રહેતા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજ પૂનગથી વિહાર કરી શીલધર પધાર્યા.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુ-
પદેશથી શીલધરથી શ્રી સિદ્ધાચલજીનો
નીકળેલો છરી પાળતો સંઘ.

પંન્યાસજી મહારાજ શીલધર પધાર્યા બાદ તેઓશ્રીના સદુપદેશથી શેઠ પૂનાજી રામાજી, ખેમાજી રામાજી, તથા કેશાજી રામાજીએ કાગણુ માસમાં શીલધરથી શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઢ્યો. સંઘ સાથે પોતાના શિષ્ય-પરિવાર સાથે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પણ વિહાર કર્યો.

સંઘમાં મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજેના ૬૦ ઠાણા હતા, શ્રાવકભાઈઓ અને શ્રાવિકાજીને વિગેરે અઢી હજાર માણસ હતા, વળી ચાર મોટર, અઢીસો ગાડાં તથા તંબુ વિગેરે પુષ્કળ સાધન-સામગ્રી હતી. સંઘે પહેલે દિવસે શીલધરથી એકગાઉ દૂર પડાવ નાખ્યો, એ દિવસે સંઘવી તરફથી નવકારશી થઈ, તથા આખા ગામમાં ધૂમાડો બંધ કરાવી અઢારે નાતના માણસોને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું. સંઘ શીલધરથી દ્વંતરાય આવતાં ત્યાંના સંઘમાં અતિશય કુસંપ હતો તે પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યો. વળી કેટલાક શ્રાવક-ભાઈઓ પાસે દેવદ્રવ્યની મોટી રકમ લેણી ખેંચાતી હતી, તે સદુપદેશ આપી પતાવીને ચોપડા ચોખખા કરાવ્યા. દ્વંતરાયથી સંઘ શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ આવતાં ત્યાંના સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. અહીં સંઘનો પડાવ ત્રણ દિવસ રહ્યો. સંઘ ત્યાંથી મઢાર આવ્યો, ત્યાં સંઘવી તરફથી ત્રણ દિવસ નવકારશી થઈ. મઢારથી ડીસાકાંપ આવતાં એક દિવસ ડીસાના સંઘ તરફથી અને એક દિવસ સંઘવી તરફથી એમ બે નવકારશી થઈ. ત્યાંથી જુના ડીસા થઈ ભીલડીયા પાર્શ્વનાથસ્વામીની યાત્રા કરી ચાણપ તીર્થ આવતાં ત્યાં સંઘનો પડાવ બે દિવસ રહ્યો. ચાણપથી સંઘ પાટણ આવ્યો અને ત્યાં ત્રણ દિવસ રોકાયો. પાટણના વિવેકી સંઘે બે દિવસ નવકારશી કરી, અને એક દિવસ શીલધરના સંઘવી તરફથી નવકારશી થઈ. પાટણથી હારીજ આવતાં ત્યાં સંઘવી તરફથી બે દિવસ નવકારશી થઈ. હારીજથી સંઘ શ્રી શંખેશ્વરજી તીર્થ આવ્યો, અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનાં દર્શન-પૂજન કરી પરમ આહલાદ પામ્યો. અહીં સંઘવીના મુનીમ

વીરચંદ્રભાઈ તરફથી એક નવકારશી થઈ. અને બીજી નવકારશી સંઘવીએ કરી. પરમાત્માને સંઘવી તરફથી કિંમતી આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા લણાવવામાં આવી. ત્યાં ત્રણ દિવસ રોકાઈ ત્યાંથી પંચાસર તથા દસાડા થઈ પાટડી આવતાં પાટડીના સંઘ તરફથી ધામધૂમથી સામેયું થયું તથા નવકારશી કરવામાં આવી. પાટડીથી સંઘ ઉપરીયાળા તીર્થ આવ્યો. ત્યાં પરમાત્માના લવ્ય પ્રતિમાજીને આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા લણાવી. વળી ભાતાખાતું વિગેરે ખાતાઓમાં સંઘવીએ રૂપિયા ૫૦૦) આપી લક્ષ્મીનો સદ્વ્યય કર્યો.

ઉપરીયાળા તીર્થથી સંઘ બળણા થઈ વઢવાણકેંપ આવ્યો. વઢવાણકેંપમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. દેવવંદનની પવિત્ર ક્રિયા પૂર્ણ થતાં સંઘવી તરફથી પેંડાની પ્રભાવના કરવામાં આવી. ત્યાંથી વઢવાણ-સીટી થઈ લીંબડી આવતાં લીંબડીના સંઘે નવકારશી કરી. ત્યાંથી ચૂડા, રાણપુર, ખોટાદ, લાઠીદડ, લાખેણી, પરછેગામ અને સણોસરા થઈ નવાગામમાં સંઘે પડાવ નાખ્યો. અહીં પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ હરિલાલ કીકાભાઈ વિગેરે સદ્ગૃહસ્થો સંઘની સામે આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી સંઘવીએ પેઢીના જીદાજીદા ખાતાઓમાં રૂપિયા ત્રણ હજારની મદદ કરી. નવાગામથી સંઘ ચૈત્ર વદિ ૧૧ ના રોજ પાલીતાણા આવતાં તેનું શાનદાર સામેયું થયું. ઇન્દ્રધ્વજ, દરબારી બેંડ, ભાવનગરનું મીકું બેંડ, પાલીતાણા શહેરનું બેંડ, ઘોડેસ્વારો તથા પાયદળ વિગેરે પુષ્કળ સાધન-સામગ્રી ઉપરાંત ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મહારાજ વિગેરે મુનિવર્યો, સાધ્વીજી મહારાજો,

અને હજારો શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકઠો થવાથી સામૈયાની શોભા દર્શનીય થઈ હતી. સંઘ ખુશાલજીવનમાં ઉતરતાં ખુશાલ-જીવનના વિશાળ હોલમાં આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે મીઠી-મધુરી વૈરાગ્યમય દેશના આપી. સંઘવીએ પાલીતાણામાં સંઘજમણ તથા જુદા ખાતાઓમાં આપેલી મદદ મળી રૂપિયા સત્યાવીશ હજારનો સદ્વ્યય કર્યો. વળી સંઘમાં આવેલા દરેક નોકરને સંજ્ઞવી તરફથી છૂટે હાથે ઈનામ આપવામાં આવ્યાં. વૈશાખ શુદ્ધ ત્રીજના શુભ દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુઞ્જય ઉપર શેઠ પૂનાજી રામાજી શેઠ ખેખાજી રામાજી, તથા શેઠ કેશાજી રામાજી, એ ત્રણે ભાઈઓએ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે તીર્થમાળ પહેરી. ત્યારબાદ સંઘ પાલીતાણાથી પાછો છરી પાળતો શીલધર પહોંચ્યો, અને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે આપેલા મુદૂતે શીલધર ગામમાં પ્રવેશ કર્યો. અહીં આવીને સંઘવીએ શીલધરના દેરાસરજી વિગેરે ધર્મોદ્ધા ખાતામાં સારી રકમ આપી. આવી રીતે શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઠી મહાન્ પુણ્ય ઉપાર્જન કરનાર સંઘવીએ કુલ બે લાખ રૂપિયાનો સદ્વ્યય કર્યો. પુણ્યશાળી સંઘવીના માનમાં સીરોહી સ્ટેટ તરફથી શીલધરના દીવાનની સહીથી ચૈત્રશુદ્ધિ ૧૩ ના રોજ શીલધરમાં પાખી પાળવાનો ઠરાવ કર્યો, એ ઠરાવનો અમલ અત્યારે પણ ચાલુ છે.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પાલીતાણામાં સંવત્ ૧૯૬૮ ના વૈશાખ શુદ્ધિ ૬ ના રોજ સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજીને વડીદીક્ષા આપી, તેમને સાધ્વીજી શ્રી

મેઘશ્રીજીના શિષ્યા કર્યા. આ વખતે શિવગંજ નિવાસી શેઠ ટેકચંદ્રજી પોરવાડના સૌભાગ્યવંતા ધર્મપત્ની પરમ વૈરાગી જ્ઞેન રતન પાલીતાણા દીક્ષા લેવા આવ્યા હતા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સૌ. જ્ઞેન રતનને તેમના પતિની અનુમતિથી સંવત ૧૯૯૮ ના વૈશાખ વદિ ૬ ના રોજ ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સાધવીજી શ્રી સૂર્યોદયાશ્રીજી રાજ્યું, અને તેમને સાધવીજી શ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.

ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વિચરતા વિચરતા ભાવનગર વડવાના ઉપાશ્રયે પધાર્યા. વડવાના સંઘે ચતુર્માસ માટે આ-ગ્રહભરી વિનતિ કરી, જેથી પંન્યાસજી મહારાજે સંવત ૧૯૯૮નું ચતુર્માસ ભાવનગર-વડવાના ઉપાશ્રયે કર્યું. ચોમાસામાં પંન્યાસજી મહારાજ હમેશાં વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેમાં વડવાના શ્રાવક-શ્રાવિકાઓ ઉપરાંત ગામમાંથી પણ કેટલાક ભાઈ-જ્ઞેનો નિયમિત હાજરી આપતા. તેઓશ્રીના સદ્ગુપદેશથી વિવિધ પ્રકારની તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં હતાં. તેઓશ્રીએ આસો માસની ઓળીમાં અર્ઘ્યાધની તપસ્યા કરી. સંવત ૧૯૯૯ ના માગશર શુદ્ધિ ૬ ના રોજ નાણુ મંડાવી પંન્યાસજી મહારાજે સાધવીજી શ્રી સૂર્યોદયાશ્રીજીને વડીદીક્ષા આપી, તેમને સાધવીજીશ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.

ત્યારબાદ પંન્યાસજીશ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને અનેક

ગામે તથા શહેરોમાં વિચરી ભવ્યાત્માઓને પ્રતિબોધ આપતા પાલીતાણા પધાર્યા. આ અરસામાં સુરતના વતની શ્રીયુત પ્રેમચંદ્રભાઈ પાલીતાણા આવ્યા હતા. સંસારના કેટલાક કડવા અનુભવ થતાં તેમનું દિલ સંસાર ઉપરથી ઉઠી ગયું હતું. વૈરાગ્યથી રંગાયેલા અને દીક્ષા લેવાની ભાવનાવાળા તેમણે દીક્ષા આપવા માટે પંન્યાસજી મહારાજને વિનંતિ કરી. તેમનો હાર્દિક વૈરાગ્ય જોઈ પંન્યાસજી મહારાજે અનુમતિ આપી. જેથી મોતી સુખીયાની ધર્મશાળામાં નાણું મંડાવી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્યે શ્રીયુત પ્રેમચંદ્રભાઈને સંવત ૧૯૯૯ના અશાઢ માસમાં ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી પ્રવીણુવિજયજી રાખ્યું, અને તેમને પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય કર્યા. તેઓશ્રીએ સંવત ૧૯૯૯ નું ચતુર્માસ પાલીતાણામાં મોતી સુખીયાની ધર્મશાળામાં કર્યું.

ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા ભાવનગર-મારવાડીને વંડે પધાર્યા. વૈશાખ શુદ્ધ ૬ ના રોજ મુનિરાજ શ્રી પ્રવીણુવિજયજીને વડીદીક્ષા આપવાની હોવાથી નાણું મંડાવવામાં આવી, એ શુભ દિવસે ચતુર્વિધ સંઘની વિશાળ મેદની વચ્ચે પંન્યાસજી મહારાજે મુનિરાજશ્રી પ્રવીણુવિજયજીને વડીદીક્ષા આપી, અને તેમને પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય કર્યા. વળી આ વખતે ખીજ પણ શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ વિવિધ પ્રકારના વ્રત ઉચ્ચર્યા. તેઓશ્રીએ ભાવનગરના સંઘની આગ્રહભરી વિનંતિથી સંવત ૨૦૦૦ ની સાલનું ચતુર્માસ

ભાવનગરમાં મારવાડીને વંડે ક્યુ". પંન્યાસજી મહારાજના સદુપદેશથી પર્યુષણમાં અઠાઈવિગેરે તપસ્યા સારા પ્રમાણમાં થઈ, તથા ચોસઠ પહોરના પોસહ ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ કર્યા, તેમને દરેકને એક એક રૂપિયાની પ્રભાવના કરવામાં આવી. ભાદરવા શુદ્ધિ પાંચમના રોજ ઠાઠમાઠથી વરઘોડો નીકળ્યો. આ ચતુર્માસ દરમ્યાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી ધર્માદાના જુદા જુદા ખાતાઓમાં મળી રૂ. ૬૦૦૦૦) નેવું હજારની મદદ મળી. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના ધર્મપત્ની જ્ઞેન સંતોક તથા જ્ઞેન દીવાળીએ રૂપિયા ૫૦૦૦૧) પચાસ હજાર એકની નાદર રકમ શેઠ ડોસાભાઈ અલેચંદની પેઢીમાં આપી અને દર સાલ પર્યુષણના આગલા દિવસે ભાવનગરસંઘના ઉત્તર પારણામાં એના વ્યાજની રકમ વાપરવી એવી વ્યવસ્થા કરી. વડવામાં આયંબિલ માટેની કેાઈ સંસ્થા નહોતી, જેથી આયંબિલ કરનારાઓને અગવડ પડતી. એ અગવડ દૂર કરવા પંન્યાસજી મહારાજના સદુપદેશથી જ્ઞેન સંતોક તથા જ્ઞેન દીવાળીએ વડવામાં પોતાના પતિ ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના નામે રૂપિયા ૫૪૦૦૦) ચોપન હજાર ખર્ચી એક મકાન ખરીદ્યું અને શ્રી વર્ધમાનતપની ઓળીનું ખાતું ખોદી એ મકાનના ભાડાની આવકમાંથી આયંબિલ કરાવવા, એવી વ્યવસ્થા કરી. તે સિવાય જ્ઞેન સંતોક તથા જ્ઞેન દીવાળીએ પંન્યાસજી મહારાજના સદુપદેશથી જુદા જુદા ગામોમાં જીર્ણોદ્ધાર, ઉપાશ્રય વિગેરે ધાર્મિક કાર્યોમાં કુલ રૂપિયા બે લાખનો સહાય કર્યો છે.

પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી

જહેન સંતોક તથા જહેન દીવાળીએ સંવત્ ૨૦૦૧ ના મહા માસમાં ભાવનગરથી શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઢ્યો, સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો. પાલીતાણા આવતાં સંઘનું શાનદાર સામૈયું થયું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મહા વહિ ૩ ના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે જહેન સંતોક તથા જહેન દીવાળીએ તીર્થમાંજ પહેરી, અને બન્ને સંઘવી જહેનોએ પાલીતાણામાં જુદા જુદા ખાતાઓમાં સારી રકમ આપી લક્ષ્મીનો સદ્વ્યય કર્યો.

ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો. અને તાલધ્વજ તીર્થની યાત્રા કરી કોળીયાક થઈ ઘોઘા આવ્યા. ત્યાં શ્રી નવખંડા પાર્શ્વનાથસ્વામીના પ્રભાવક પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી હર્ષોદ્ઘાસ પામ્યા.

ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયા-જહેનની, પંન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં ખ્યાવરમાં ઉપધાન કરાવવાની ભાવના હતી. જેથી “પંન્યાસજી શ્રી કંચન-વિજયજી મહારાજ ઘોઘા પધાર્યા છે” એવા સમાચાર મળતાં તેઓ ઘોઘા આવ્યા. તેમની સાથે શેઠ કલ્યાણચંદજી મુહરતા વિગેરે ૨૫ શ્રાવક-શ્રાવિકાઓ આવ્યા હતા. તેમણે ઉપધાન કરાવવા માટે ખ્યાવર પધારવા આશ્રહલરી વિનતિ કરી. આજ્ઞાશીલ પંન્યાસજી મહારાજે કહ્યું કે, ગુરુદેવની આજ્ઞા મળ્યાબાદ અમારાથી ખ્યાવર આવવાની હા કહી શકાશે. આ પ્રમાણે પંન્યાસજી મહારાજના કહેવાથી તેઓ ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ ખાસે

જોટાણા જઈ આજ્ઞા લઈ આવ્યા, જેથી પંન્યાસજી મહારાજે
ખ્યાવર આવવાની સમ્મતિ આપતાં ખ્યાવરવાળા ઘણુંજ ખુશી
થયા, અને તેઓ પાછા ખ્યાવર ગયા, ત્યારબાદ પંન્યાસજી
મહારાજ ઘોઘાથી વિહાર કરી ભાવનગર આવ્યા, ત્યાં ચૈત્રી
ઓળી કરી, અને ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા.

ભાવનગરથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના
શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કર્યો, અને
વિચરતા વિચરતા જેઠ વદિ ૧૧ ના રોજ ખ્યાવરથી પાંચ
ગાઉ દૂર સેંદ્રા નામના ગામમાં પહોંચ્યા. પંન્યાસજી મહારાજ
સેંદ્રા આવી ગયા છે, એવા સમાચાર મળતાં ખ્યાવરથી ૫૦૦
શ્રાવક-શ્રાવિકાઓ સેંદ્રા સામા આવ્યા, અને ત્યાં સાધર્મિક
વાત્સલ્ય કર્યું. સેંદ્રાથી પંન્યાસજી મહારાજ ખ્યાવર પધાર્યો,
અને ખ્યાવરની બહાર કાળુરામ કાંકરીયાની ધર્મશાળામાં
ઉતર્યા. અહીં પાંચેક દિવસ રોકાયા બાદ અસાડ શુદ્ધિ ૩ ના
રોજ ખ્યાવર શહેરમાં પ્રવેશ કરતાં સંઘ તરફથી ઠાઠમાઠથી
સામૈયું થયું. દેરાસરજી પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા. ખ્યાવરના
સંઘની આગ્રહબરી વિનિતિથી પંન્યાસજી મહારાજે સંવત્
૨૦૦૧ નું ચતુર્માસ ખ્યાવરમાં કર્યું. પંન્યાસજી મહારાજ
વ્યાખ્યાનમાં હંમેશાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવના-
ધિકારે યુગાદિ દેશના વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશ-
નાની સુવાસ ચોતરફ પ્રસરી ગઈ, જેથી ભૂતિપૂજક શ્રાવક-
શ્રાવિકાઓ ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી, અને દિગંબર
ભાઈ-ખેનો પણ વ્યાખ્યાન સાંભળવા આવતા. વળી જૈનેતર
પણ ઘણા ભાઈઓ દેશનાનો લાલ લેવા દાર્ઘમસર હાજરી
આપતા. તેઓશ્રીના સદુપદેશથી પશુપક્ષ પ્રસંગે મારવાડી

તથા ગુજરાતી શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણ, સોળ ઉપવાસ, તથા અઠાઈ વિગેરે તપસ્યા સારા પ્રમાણમાં કરી. વળી પર્યુષણ પ્રસંગે તપસ્વી શ્રીયુત શેઠ ઉમેદમલે માસખમણની તપસ્યા કરી, તે નિમિત્તે તેમના તરફથી ૧૬ દિવસ સુધી ઠાઠમાઠથી આંગી રચાવવામાં આવી, તથા હંમેશાં જુદી જુદી પૂજાઓ ભણાવી પ્રભાવના કરવામાં આવી હતી. પર્યુષણનો વરઘોડો ઠાઠમાઠથી ચડ્યો. ચતુર્માસ પૂર્ણ થતાં ભાવનગરવાળા ભાવસાર જીવણભાઈ રામજી માસ્તરને ઘેર ચોમાસું બદલ્યું. ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેન તરફથી કારતક વદિમાં કાળુરામજી કાંકરીયાના નોરામાં ઉપધાન બેઠા. તેમાં મુમુક્ષુ ઘણા શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ પ્રવેશ કર્યો. તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો. તેમના તરફથી તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ. ઉપધાનની માળ નિમિત્તે પોષ માસમાં ધામધૂમથી વરઘોડો નીકળ્યો. અને પંન્યાસજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓએ તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને ઉપધાનની માળ પહેરી.

આ અરસામાં ઉદયાબહેન તથા શેઠ શંકરલાલ મુણોત તરફથી પાલીતાણાથી ચાર ભવ્ય પ્રતિમાજી લાવવામાં આવ્યા હતા. પંન્યાસજી મહારાજના શુભ હસ્તે એ મનોહર ચારે પ્રતિમાજીને ખ્યાવરના દેરાસરજીમાં ધામધૂમથી તખ્તનશીન કરવામાં આવ્યા, અને તે નિમિત્તે વિધિ-વિધાનપૂર્વક અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું.

ત્યાર બાદ શેઠ શંકરલાલ મુણોતે પોતાને બંગલે પધારવા આગ્રહભરી વિનંતિ કરવાથી પંન્યાસજી મહારાજ પોતાના શિષ્ય-

પરિવાર સાથે ખ્યાવર શહેરની બહાર આવેલા શેઠ શંકરલાલ મુલોતને બંગલે પધાર્યા, ત્યાં એક મહિના સુધી સ્થિરતા કરી. પંન્યાસજી મહારાજના વૈરાગ્યમય સદુપદેશથી ભદ્રક પરિણામી શેઠ શંકરલાલ મુલોત તથા તેમના શ્રદ્ધાળુ ધર્મ-પત્નીએ પંન્યાસજી મહારાજ પાસે યથાશક્તિ વ્રત-પચ્ચખખાણ ઉચ્ચર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પંન્યાસજી મહારાજ વિચરતા વિચરતા ઉદયપુર થઈ શ્રી કેસરીયાજી તીર્થ આવ્યા, અને શ્રી કેસરીયા નાથનાં દર્શન-વંદન કરી આત્મિક ઉદ્ધાસ પામ્યા. માર્ગમાં આવતા ગામે તથા શહેરોમાં સ્થાનકવાસી અને તેરાપંથીઓને પ્રતિબોધ આપી કેટલાકને મૂર્તિ-પૂજા પ્રત્યે શ્રદ્ધાળુ કર્યા, અને કેટલાકને અભક્ષ્ય-અનંતકાયનો ત્યાગ કરાવ્યો. ખ્યાવરથી કેસરીયાજી સુધીનો વિહારનો ખર્ચ શેઠ સુગનમલજી મુહતા તરફથી મળ્યો હતો. કેસરીયાજીથી વિહાર કરી ઉદયપુર, સાયડા, અને રાણુકપુર થઈ સાદડી આવી ત્યાં ફાગણ ચોમાસી ચૌદશ કરી. ત્યાંથી વિહાર કરી જાકોડા તીર્થ પધાર્યા. અહીં નેવી તથા શીવગંજના સંઘના અગ્રેસરોએ આવી ચોમાસા માટે વિનંતિ કરી, પરંતુ ચતુર્માસને હજી વાર હોવાથી ચતુર્માસ માટે હા ન પાડી. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે જાકોડાથી વિચરતા વિચરતા સુમેરપુર આવ્યા. ત્યાં શિવગંજના સંઘની વિનંતિથી શિવગંજ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. આગમ-શાસ્ત્રના પારગામી સુવિહિત વિદ્વાન મુનિવર્યો પોતાના ગામમાં પધારવાથી હર્ષોલ્લસિત થયેલ નગરશેઠ તખતમલજી વિગેરે સદ્ગૃહસ્થોએ સમૈયામાં રૂપિયા ૨૫૦) ઉછાળી શુદ્ધભક્તિ પ્રદર્શિત કરી. પંન્યાસજી

મહારાજે શિવગંજના સંઘને સદુપદેશ આપી દેરાસરજીના જીર્ણોદ્ધારનું કામ ચાલુ કરાવ્યું. આ વખતે સીરોહીના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવવાનો હોવાથી સીરોહીના સંઘના અગ્રેસરે શિવગંજ આવ્યા, અને સીરોહી પધારવા વિનતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ શિવગંજથી વિહાર કરી સીરોહી આવ્યા, અને દેરાસરજી ઉપર ધામધૂમથી વિધિ-વિધાનપૂર્વક ધ્વજદંડ ચડાવવામાં આવ્યો. તે નિમિત્તે સંઘ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ થયો, અને વિધિપૂર્વક શાંતિસ્નાત્ર લણાવ્યું.

આ અરસામાં જવાલના સંઘના અગ્રેસરે સીરોહી આવ્યા તેમણે ચતુર્માસ માટે જવાલ પધારવા આગ્રહભરી વિનતિ કરી; જેથી તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે સીરોહીથી વિહાર કર્યો. અને ગોહિલી તથા ઉડ ગામ થઈ જવાલ પધારતાં સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. પંન્યાસજી મહારાજે સંવત ૨૦૦૨ નું ચતુર્માસ જવાલમાં કર્યું. જવાલમાં આયંબિલ કરનાર ભાઈ-જહેનો જૈન વંડામાં આયંબિલ કરવા જતા, એ માટે સ્વતંત્ર મકાન તથા ફંડ નહોતું; જેથી પંન્યાસજી મહારાજે આયંબિલ ખાતા માટે સદુપદેશ આપતાં શેઠ ગેનમલજી લલુતમલજીનાં માતુશ્રી ચંપાજહેને રૂપિયા દસહજાર આપ્યા, તથા ખીજ શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા જહેનોના મળી રૂપિયા ૯૦૦૦૦) નેવું હજાર થયા. આવી રીતે એકઠા થયેલા રૂપિયા એક લાખમાંથી એક પાકું મકાન બંધાવવામાં આવ્યું. એ મકાનમાં આયંબિલ ખાતું ખુલ્લું મૂક્યું, તથા જૈનશાળા ચાલુ કરવામાં આવી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી

જૈન સ્કુલનું મકાન બંધાવવા બીજા એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવામાં આવ્યું.

પૂનગ ગામના સંઘમાં કેટલાક વખતથી કુસંપ ચાલતો હતો, જેથી ત્યાંના પંચમાં તડ પડી ગયા હતા. એ કુસંપ દૂર કરાવવા પુનગના સંઘના અગ્રેસરો ચોમાસા બાદ પંન્યાસજી મહારાજ પાસે જવાલ આવ્યા, તેમણે પુનગ પધારવા વિનંતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ જવાલથી વિહાર કરી પુનગ પધાર્યા, અને સચોટ સદુપદેશ આપી ત્યાંના સંઘમાં કેટલાક વખતથી પેઠેલો કુસંપ દૂર કરાવ્યો. ત્યારબાદ તેઓશ્રી પુનગથી વિહાર કરી પાછા જવાલ આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી ભિન્ન ભિન્ન ગૃહસ્થો તરફથી જવાલથી જેસલમેરનો છરી પાળતો સંઘ નીકળ્યો. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્ય-પરિવાર સાથે વિહાર કર્યો. અને જોગાપરા, કેરટા, કેરાલ, પાવઠા, ઉમેદપુર, ગુડા-બાલોતરા, તથા આહોર થઈ સંઘ સાથે શ્રી નાકોડા તીર્થ આવ્યા. ત્યાં શ્રી નાકોડા પાર્શ્વનાથસ્વામીનાં દર્શન-વંદન કરી પરમઆનંદ પામ્યા. નાકોડા તીર્થમાં સંઘ તરફથી ઠાઠમાઠથી પૂજા લણાવવામાં આવી, તથા સાધર્મિક વાત્સલ્ય થયું. ત્યાંથી સંઘ સાથે બાડમેર આવ્યા, અહીં બાડમેરના સંઘના અતિશય આગ્રહથી આઠ દિવસની સ્થિરતા કરી. બાડમેરથી સંઘ સાથે વિચરતા વિચરતા જેસલમેર આવ્યા. જેસલમેરમાં પ્રાચીન અને ભવ્ય દેરાસરો તથા જ્ઞાનભંડારો જોઈ આનંદ પામ્યા, તથા પ્રભાવક પ્રતિભાજીઓનાં દર્શન-વંદન કરી આત્મિક ઉદ્ધાસ અનુભવ્યો. જેસલમેરમાં ચાર દિવસની સ્થિરતા કરી ત્યાંથી સંઘ સાથે વિચરતા વિચરતા ફલોદી આવ્યા. અહીંથી સંઘ

ટ્રેનમાં જાવા લ ગયો, અને પંન્યાસજી મહારાજ ક્લોદીમાં રોકાયા. અહીં તેઓશ્રી હંમેશાં વ્યાખ્યાન વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશના સાંભળવા મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાઓ ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી તથા જૈનેતરભાઈઓ પણ પુષ્કળ આવતા. વ્યાખ્યાન-હાલ ચીકાર ભરાઈ જતો. ક્લોદીના સંઘે ચોમાસા માટે આગ્રહભરી વિનંતિ કરી, પરંતુ ચતુર્માસને હજી વાર હોવાથી પંન્યાસજી મહારાજે હા ન કહી.

ક્લોદીમાં એક મહિનાની સ્થિરતા કર્યા બાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યો, અને વિચરતા વિચરતા ઓસીયા પધાર્યા. અહીં ઓસીયા જૈન બોર્ડિંગની વીજીટ લીધી. બોર્ડિંગની સુવ્યવસ્થા તથા વિદ્યાર્થીઓમાં વિનય-વિવેક અને ધાર્મિક સંસ્કાર જોઈ ખુશી થયા. ત્યાંથી કાપરડાજી તીર્થ આવી ત્યાં ચાર દિવસ રોકાયા. કાપરડાજીથી પોતાના શિષ્ય-પરિવાર સાથે વિચરતા વિચરતા પાલી પધાર્યા. પાલીના શ્રીસંઘે પંન્યાસજી મહારાજને ચતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતિ કરતાં તેઓશ્રીએ ગુરુ મહારાજની આજ્ઞા લેવા સૂચના કરી. જેથી સંઘના અગ્રેસરો આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે સાદડી મુકામે ગયા, અને ત્યાંથી તેઓશ્રીની આજ્ઞા લઈને આવ્યા. જેથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત્ ૨૦૦૩ નું ચાતુર્માસ પાલીમાં કર્યું. ચોમાસા દરમિયાન તેઓશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુઞ્જય માહાત્મ્ય તથા ભાવનાધિકારે શ્રી ભુવનભાતુ કેવલિ ચરિત્ર વાંચ્યું. તેઓશ્રીના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં.

આ વખતે ચુડા નિવાસી શા. ઉમેદચંદ મલુકચંદ પંન્યાસજી મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે પંન્યાસજી મહારાજનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રીફળની પ્રભાવના કરી, તથા પાલીના સંઘમાં દરેક ઘેર જરમન-સીલ્વરના વાટકાની લાણી કરી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી તેમણે શ્રી શાંતિનાથ ભગવાનના હેરાસરજીના જીર્ણોદ્ધાર માટે તથા ટેકરીના હેરાસરજીના જીર્ણોદ્ધાર માટે અઢી હજાર રૂપિયા પાલીના શ્રીસંઘને અર્પણ કર્યા.

ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીથી વિહાર કર્યો. અને આઉવા, જાકોડા, શિવગંજ તથા નોવી થઈ જોગાપરા આવ્યા. અહીંના સંઘમાં ઘણા વખતથી કુસંપ ચાલ્યો આવતો હતો, પંન્યાસજી મહારાજ સંવત્ ૧૯૯૭ ની સાલમાં જોગાપરા આવેલા ત્યારે તેઓશ્રીએ સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યો હતો. જેથી સંઘમાં કેટલોક વખત સંપ અને સહકારની સુવાસ ફેલાણી હતી. પરંતુ 'કેટલાક કલેશપ્રિય ભાઈઓની દોરવણીથી સંઘમાં વળી પાછો કુસંપ પેઠો હતો. પંન્યાસજી મહારાજે પ્રયાસ કરી તથા સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યો. ત્યારબાદ તેઓશ્રી જોગાપરાથી વિહાર કરી જાવાલ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. અહીં મહારનિવાસી ઓસવાળજ્ઞાતિના પરમવૈરાગી સંતોડખેન દીક્ષા અંગીકાર કરવા આવ્યા. તેમની સાથે તેમના શ્વશુર પક્ષના દિયર વિગેરે તથા પિયર પક્ષનાં માણસો આવ્યા હતા. તેમના તરફથી ઠાઠમાઠથી દીક્ષાનો વરઘોડો ચડાવવામાં આવ્યો. વળી તેમના તરફથી પૂજા, પ્રભાવના, આંગી તથા સાધર્મિક વાત્સલ્ય

કરવામાં આવ્યું. સંવત ૨૦૦૪ ના મહા વદિ ૪ ના રોજ પંચાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે જાહેન સંતોકને ભાગવતી દીક્ષા આપવામાં આવી, તેમનું નામ સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી રાખ્યું, અને તેમને સાધ્વીજી શ્રી સુર્યોદયાશ્રીજીના શિષ્યા કર્યા.

ત્યારબાદ પંચાસજી મહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે જવાલથી વિહાર કર્યો. અને પાડીવ વિગેરે ગામોમાં વિચરતા વિચરતા અણાદરા થઈ આખું તીર્થ આવ્યા. ત્યાં આઠ દિવસની સ્થિરતા કરી અચલગઢની યાત્રા કરી ખરેડી આવતાં ત્યાં ત્રણ દિવસ રોકાયા ત્યાંથી વિહાર કરી પાલણુપુર અને સિદ્ધપુર થઈ, કંબોઈ તીર્થની યાત્રા કરી, હારીજ થઈ શ્રી શંખેશ્વરજી પધાર્યા; ત્યાં ચાર દિવસની સ્થિરતા કરી. શંખેશ્વરજીથી વિહાર કરી લીલાપુર, સીયાણી, લીંબડી, રાણુપુર, લાઠીદડ અને પચ્છેગામ થઈ સોનગઢ આવ્યા. ત્યાં ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સોનગઢથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને મોખડકા થઈ ચૈત્ર વદિ ૭ ના રોજ પાલીતાણામાં પ્રવેશ કરતાં ભવ્ય સામૈયું થયું, તેઓશ્રી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે પાલીતાણામાં જૈન સાહિત્ય મંદિરમાં ઉતર્યા. અહીં વરતેજ નિવાસી પરમ વૈરાગી ભાવસાર શાંતિલાલ પ્રાગજી વાંકાણીને આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે સંવત ૨૦૦૪ ના વૈશાખ શુદ્ધ ૫ ના શુભ દિવસે ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી સંયમ-વિજયજી રાખવામાં આવ્યું, અને તેમને પંચાસજી શ્રી

કંચનવિજયજી ગણિવર્યના શિષ્ય કર્યા. વળી મુનિરાજ શ્રી સંયમવિજયજીને આચાર્ય મહારાજના શુભ હસ્તે જોઈ શુદ્ધિ ૬ ના રોજ વડી દીક્ષા આપવામાં આવી, અને તેમને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય કર્યા. પંન્યાસજી મહારાજે ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત ૨૦૦૪ નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું.

તીર્થાધિરાજ શ્રી શત્રુઞ્ચની શીતલ છાયામાં સમતારસને ઝીલતા પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્યે અશાઢ શુદ્ધિ ૧૩ થી એકત્રીશ ઉપવાસની ઉત્ત્ર તપશ્ચર્યા આદરી. એ તપસ્યા નિમિત્તે સીરોહી નિવાસી શેઠ સમરથ-મલજી તરફથી તથા ભાવસાર ભાઈ-બહેનો તરફથી, એમ બે અઠ્ઠાઈ-મહોત્સવ ધામધૂમથી ઉજવાયા. તેમાં હમેશાં સુંદર રાગ-રાગણીથી સંગીતની રમઝટ સાથે વિવિધ પૂજાઓ લણાવવામાં આવી, પ્રભાવનાઓ થઈ, તથા પરમાત્માના પ્રતિમાજીઓને અંગરચના કરાવવામાં આવી. વળી ભાવસાર પ્રમોદરાય જગજીવનદાસ ગુંદીગરા તરફથી વિધિ-વિધાન સાથે નવાણું અભિષેકની પૂજા લણાવવામાં આવી, અને ભાવસાર રતિલાલ છગનલાલ વેલાણી તરફથી ઘણા જ ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. વરઘોડામાં સ્થાનિક સંઘ, સંખ્યાબંધ યાત્રિકો, તથા ભાવનગર, વરતેજ વિગેરે સ્થળેથી આશરે ૨૫૦ ભાવસાર ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. શ્રાવણ શુદ્ધિ ૧૫ ના રોજ પારણું કરવાનું હતું. તે દિવસે સવારમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્યે ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને વંદન કરી પરચખાણુ દીધા બાદ પોતે ગુરુદેવના ચરણ-કમલનું પ્રક્ષાલન કર્યું. અને

પારણામાં એ પ્રક્ષાલન જલ વાપર્યા પછી બીજી વસ્તુઓ વાપરી. ધન્ય છે ગુરુદેવ ઉપર અવિહત ભક્તિશાળી પંન્યાસજી મહારાજને !

ચોમાસા બાદ ભાવસાર સાકરચંદ્ર ગાંડાલાલ વેલાણી તરફથી વરતેજમાં અઠ્ઠાઈ-મહોત્સવ કરવાનો હોવાથી તેમના તરફથી આગ્રહભરી વિનંતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી મહારાજે માગશર વદિ ૩ ના રોજ પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વરતેજ આવ્યા. ત્યારબાદ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ પોતાના બહોળા સાધુ-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કરી વરતેજ પધાર્યા. ત્યાં ભાવસાર સાકરચંદ્ર ગાંડાલાલ વેલાણી તરફથી ધામધૂમથી અઠ્ઠાઈ-મહોત્સવ ઉજવાયો અને ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યો. અઠ્ઠાઈ-મહોત્સવનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ ગુરુદેવ વિ. મુનિવર્યો સાથે વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વંડે ઉતર્યા. ભાવનગરમાં ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે મોટા દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં ભવ્ય પ્રતિમાજીની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એ સમયે પરમ પ્રભાવક એ બન્ને પ્રતિમાજીને આખા શરીરે અમી ઝરવા લાગી હતી. વળી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે વડવાના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવવાની ક્રિયા કરાવી; એ શુભ સમયે વડવાના દેરાસરજીના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય પ્રતિમાજીને અંગુઠેથી અમી ઝરી હતી.

ત્યારબાદ પંન્યાસજી મહારાજ માર્વાડીને વડેથી કૃષ્ણ નગરના ઉપાશ્રયે પધાર્યા. ત્યાં તેઓશ્રીએ છ આયંનિવ ઉપર અકુંભ તપ કરી ચૈત્રી જોગીની આરાધના કરી. વળી શા. ક્રાંતિલાલ છમનલાલ દલીરાગા તરફથી ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા અને તીર્થોધિરાજ શ્રી યતુર્ભાસ ઉપર શ્રી આદીધર દાદાનાં દર્શન-વંદન કરી પરમ આહવાદ પામ્યા. પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વૈશાખ વદિ ૬ ના રોજ વિહાર કર્યો, અને રાશળી તથા દેવગીવા ઋદ્ધ શ્રી તાલ-ધરજ તીર્થની યાત્રા કરી. તમામમાં થોડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ત્યાં માર્વાડીને વડે ઉતર્યા. ભાવનગરના ભાવિક સંઘની આગ્રહભરી વિનંતિથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીધરે સુવંત ૨૦૦૫ નું ચતુર્માસ ભાવનગરમાં કરવાનું સ્વીકૃત્યું છે, અને હાલમાં તેઓશ્રી પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરમાં-માર્વાડીના વંડામાં બિરાજે છે.

ભાવનગર.	}	નિવેદક,
સંવત્ ૨૦૦૫		મુદ્દેવચરણોપાસક-
અસાદ મુદિ ૧૫ રવિવાર		ધીરજલાલ પ્રભુદાસ વેલાણી

પાલીતાણા-થી ગહાદુરસિંહજી પ્રી. પ્રેસમાં
સા. નગરવંદ નેચરલસે છાપ્યું.

